

ખેડૂતોપયોગી સંશોધન ભલામણો ૨૦૧૮



આણંદ ફૂષિ યુનિવર્સિટી

ગુણવત્તા અને વિશ્વસનીયતાનું પ્રતિક

‘અનુભવ સીડ’



આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત અગત્યના પાકોની સુધારેલ/સંકર જાતોના બિયારણ અધ્યતન પ્રોસેસિંગ પ્લાન્ટમાં પ્રોસેસ કરી, કોઈપણ પ્રકારની ભેળસેળને અવકાશ ન રહે તે માટે સીલબંધ બેગ (નોન વુવન ફેબ્રિક્સ /પીવીસી પેકેટમાં) “અનુભવ સીડ્સ” ના નામથી પેક્ચિંગ કરી વેચાણ કરવામાં આવે છે. આ ઉપરાંત અગત્યના ફળપાકો અને ફૂલછોડના રોપા/કલમોનું પણ વેચાણ કરવામાં આવે છે.

ખેડૂતમિત્રોએ બિયારણ તેમજ રોપા/કલમો નીચે દર્શાવેલ સરનામે/ફોન સંપર્ક સાધવાથી જરૂરી માર્ગદર્શન મળશે.

બિયારણ	નોડલ ઓફિસર (સીડ) અને સંશોધન વૈજ્ઞાનિક રીજિયોનલ રીસર્ચ સ્ટેશન, આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ - ૩૮૮ ૧૧૦ ઈ-મેઇલ : nodalofficerseed@aau.in	ફોન નંબર ૦૨૬૯૨-૨૬૦૩૨૮ ૦૨૬૯૨-૨૬૪૨૩૪
રોપા/કલમો	પ્રાધ્યાપક અને વડા, બાગાયતશાસ્ક વિભાગ બં.અ. કૃષિ મહાવિદ્યાલય આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - ૩૮૮ ૧૧૦ ઈ-મેઇલ : shahnitin1968@aau.in	ફોન નંબર ૦૨૬૯૨-૨૬૨૩૭૫ ૦૨૬૯૨-૨૬૦૨૫૦



ખેડૂતોપયોગી સંશોધન ભલામણો

૨૦૧૮

: સંપાદકો :

ડૉ. અરુણ પટેલ
ડૉ. એન.વી. સોની
ડૉ. એચ. બી. પટેલ
ડૉ. ડી. ડી. પટેલ
ડૉ. મુકેશ આર. પટેલ

પ્રકાશક

વિસ્તરણ શિક્ષણ નિયામક
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કયેરી
પ્રકાશન વિભાગ, યુનિવર્સિટી ભવન
આણંદ ફૂષિ યુનિવર્સિટી, આણંદ - ૩૮૮૧૧૦
ફોન : (૦૨૬૬૨) ૨૬૨૩૧૬
ઈ-મેઇલ : dee@aau.in

ખેડૂતોપયોગી સંશોધન ભલામણો ૨૦૧૮

સંપાદકો	:	ડૉ. અરુણ પટેલ, ડૉ. એન.વી. સોની, ડૉ. એચ. બી. પટેલ ડૉ. ડી. ડી. પટેલ, ડૉ. મુકેશ આર. પટેલ
પ્રકાશન વર્ષ	:	૨૦૧૮
પ્રકાશન શ્રેણી નં.	:	EXT- ૩ : ૧૪ : ૨૦૧૮ : ૫૦૦૦
પ્રત	:	૫૦૦૦
કિંમત	:	વિના મૂલ્યે
પ્રકાશક	:	ડૉ. અરુણ પટેલ વિસ્તરણ શિક્ષણ નિયામક આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ
①	:	આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ સર્વ હક્ક પ્રકાશકને સ્વાવિન આ પ્રકાશન અંગેનું ન્યાયક્ષેત્ર આણંદ ખાતે રહેશે
પ્રકાશન સ્થળ	:	આણંદ
મુદ્રક	:	સર્વોદય ઓફસેટ ૧૩, ગજાનંદ એસ્ટેટ, જૂના માણેક ચોક મિલ કમ્પાઉન્ડ ઈંગાહ પોલીસ ચોકી પાસે, પ્રેમદરવાજા પાછળ, અમદાવાદ- ૧૬ ફોન : (૦૭૯) ૨૨૧૭૪૫૧૮



કુલપતિ
આણંદ કૃષિ યુનિવર્સિટી
આણંદ

શુભેચ્છા સંદેશ

કૃષિ ક્ષેત્રના વિકાસ માટે સંશોધનો અતિ આવશ્યક છે. આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા કૃષિના વિકાસ માટે સંશોધનની કામગીરી કરવામાં આવે છે. મધ્ય ગુજરાતના ખેડૂતોના લાભાર્થી વિવિધ સંશોધન કેન્દ્રો ઉપર અભતરાઓ ગોઠવી વિવિધ સંશોધનો હાથ ધરવામાં આવે છે જેના પરિણામોની સમીક્ષા સંશોધનોની પેટા સમિતિઓની બેઠકમાં કરવામાં આવે છે. ચ્યારિને અંતે ખેડૂતોને ઉપયોગી થાય તેવા સફળ તારણોને ખેડૂતોના ઉપયોગ સારુ ભલામણ કરવા રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટીઓની કૃષિ સંશોધનની સમિતિની સંયુક્ત બેઠકમાં રજૂ કરવામાં આવે છે. સદર બેઠક દરમ્યાન દરેક દરેક સફળ તારણો ઉપર વિચાર વિર્મર્શ કર્યા બાદ ખેડૂતમિત્રોને જેતીમાં ઉપયોગી થાય તેવા તારણો મધ્ય ગુજરાતના ખેડૂત સમૃદ્ધયના લાભાર્થી 'ખેડૂતોપયોગી સંશોધન ભલામણો' સ્વરૂપે બહાર પાડવામાં આવે છે. આવા સંશોધનના ફાયદાકારક પરિણામોનું સંકલન કરી ખેડૂતભાઈઓ સમજ શકે તેવી સરળ ભાષામાં તૈયાર કરી પુસ્તિકા રૂપે પ્રસિદ્ધ થતી આ પુસ્તિકા વિસ્તરણ કાર્યકરો તેમજ ખેડૂતોને ખૂબ જ માર્ગદર્શન અને ઉપયોગ બની રહેશે.

સદર પુસ્તિકા તૈયાર કરવામાં વિસ્તરણ શિક્ષણ નિયામકક્ષી ડૉ. અરૂણ પટેલ તથા વિસ્તરણ શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓએ કરેલ પ્રસંશનીય કામગીરી બદલ સર્વને હાર્દિક આભિનંદ પાઠવું દું.

યુનિવર્સિટી દ્વારા કૃષિ, હવામાન, જમીન અને કુદરતી સંસાધનોની ઉપલબ્ધતાઓને ધ્યાને લઈ પાડોની ખેત પદ્ધતિ, મૂલ્યવર્ધન અને પશુપાલન તથા ડેરી માટે વિવિધ તાંત્રિકતાઓ વિકસાવી 'ખેડૂતોપયોગી સંશોધન ભલામણો - ૨૦૧૮' પુસ્તિકા બનાવવામાં આવેલ છે. આ સંશોધન ભલામણો ખેડૂતો તેઓના ખેતરમાં અપનાવી ગુણવત્તાયુક્ત ખેત પેદાશો ઉત્પન્ન કરશે તેમજ ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના આહવાનને સફળ બનાવશે તેવી અપેક્ષા રાખું દું.


(અન.સી. પટેલ)

અનુક્રમણિકા

ક્રમ	વિષય	પૃષ્ઠ ક્રમાંક
૧	વિવધ પાકોની સુધારેલી / સંકર જાતો	૫
૨	ધાન્ય પાકો	૧૦
૩	કઠોળ પાકો	૧૪
૪	રોકડીયા પાકો	૧૬
૫	મરીમસાલા પાકો	૧૮
૬	તેલીબિયા પાકો	૧૯
૭	શાકભાજ પાકો	૨૫
૮	ધાસચારા પાકો	૨૩
૯	ઓષ્ઠવિય પાકો	૨૫
૧૦	ફળ પાકો	૨૬
૧૧	કૂલ પાકો	૨૭
૧૨	ટેરી વિશાન	૨૮
૧૩	કૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી	૩૬
૧૪	કૃષિ ઇજનેરી	૪૬
૧૫	પણુ પોષણ	૪૮
૧૬	મત્સ્ય પાલન	૫૩
૧૭	ઈન્ફોર્મેશન ટેકનોલોજી	૫૩

(૧) વિવિધ પાકોની સુધારેલી / સંકર જતો

૧.૧ મગાફળી : ગુજરાત મગાફળી ૩૪ (શુણ્ણ ૩૪) :



ગુજરાત રાજ્યમાં ઉનાળુ ઋતુમાં ઉભડી મગફળી ઉગાડતા ખેડૂતોને ગુજરાત મગફળી ઉધે (જીજી ઉધે) જાતનું વાવેતર કરવા માટે ભલામણ કરવામાં આવે છે. આ જાતમાં ડોડવાનું સરેરાશ ઉત્પાદન પ્રતિ હેકટર ૩૭૧૫ કિ.ગ્રા. મળેલ છે, જે સ્થાનિક જાત જીજી-૬, જીજેજી-૩૧, ટીજી ૨૬ અને ટીજી ૩૭ એ કરતા અનુકૂમે ર૨.૪, ૨૧.૬૬, ૧૨.૧૪ અને ૫.૬૨ ટકા વધારે માલ્યમ. પડેલ છે. આ જાત અંકુશ જાતો કરતાં દાણાનું ઉત્પાદન (૨૫૨૫ કિ.ગ્રા./હે.), તેલ ઉત્પાદન (૧૩૩૪ કિ.ગ્રા./હે.) અને તેલનું પ્રમાણ (૫૨.૮%) વધારે ધરાવે છે. આ જાતમાં શ્રિષ્ટ અને તડતડીયાનો ઉપદ્રવ અંકુશ જાતો કરતા ઓછો જોવા મળેલ છે. ઉનાળુ ઋતુમાં આ જાતમાં ટીક્કા અને ગેડુનો રોગ જોવા મળેલ નથી.

- સંશોધન વૈજ્ઞાનિક, વિભાગીય સંશોધન કેન્દ્ર, આકૃત્યુ, આણંદ-૩૮૮૧૧૦
ફોન: (૦૨૬૪૮) ૨૬૦૩૨૮ • ઈ-મેઈલ: nodalofficerseed@aau.in

૧.૨ ટામેટા : ગુજરાત આણંદ ચેરી ટામેટા-૧ (જુઅટીસી-૧)



ચેરી ટામેટાની 'ગુજરાત આણંદ ચેરી ટામેટા-૧' જાતનું સરેરાશ ઉત્પાદન ૧૧૪.૭ ક્રિવ./હે. જેટલું આવે છે, જે અંકુશ જાત એસીટીએલ ૧૦-૦૬ (૭.૫૨ ક્રિવ./હે.) કરતાં ૫૨.૫ ટકા વધારે છે. અનિયંત્રિત વૃદ્ધિવાળી આ જાતના પાન ઘાટા લીલા રંગના હોય છે તથા કિનારી પર ઓછા ખાંચા ધરાવે છે. આ જાતના ફળો આકર્ષક લાલ રંગના, લંબગોળ, ઓછી બીજની સંખ્યાવાળા અને વધારે ટકાઉ શક્તિ ધરાવે છે. આ જાતમાં કોકડવાનો રોગ તેમજ પાનકોરીયાનો અને ફળ કોરી ખાનાર ઈયણનો ઉપદ્રવ પ્રમાણમાં ઓછો જોવા મળે છે. આ જાતના ટામેટામાં કુલ દ્રાવ્ય ધન પદાર્થ, લાઈકોપીન અને કુલ દ્રાવ્ય શર્કરાનું પ્રમાણ અંકુશ જાત કરતાં વધારે જોવા મળે છે. આ જાતને મધ્ય ગુજરાતમાં પાછોતરા ચોમાસા-શિયાળામાં વાવેતર માટે ભલામણ કરવામાં આવે છે.

- સંશોધન વૈજ્ઞાનિક, મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર, આકૃય, આણંદ-૩૮૮૧૧૦
ફોન : (૦૨૬૫૨) ૨૬૦૨૫૧ • ઈ-મેઈલ : rsmvrs@aau.in

૧.૩ હાઈબ્રિડ મકાઈ : ગુજરાત આણંદ પીળી મકાઈ હાઈબ્રિડ -૩ (જુઅવાયએમએચ-૩)



મધ્ય ગુજરાત માટે મકાઈની સંકર જાત 'ગુજરાત આણંદ પીળી મકાઈ હાઈબ્રિડ ૩' ની રવી ઋતુ દરમ્યાન વાવેતર કરવા માટે ભલામણ કરવામાં આવે છે. આ સંકર જાત શિયાળુ વાવેતરમાં સરેરાશ ફફાહ કિ.ગ્રા./હેકટર દાણાનું ઉત્પાદન આપે છે જે અંકુશ જાત ગુજરાત મકાઈ-૨, ગુજરાત આણંદ પીળી સંકર મકાઈ-૧ અને ગુજરાત આણંદ સફેદ સંકર મકાઈ-૨ કરતા અનુક્રમે ૩૫.૬, ૩૪.૮ અને ૨૮.૨% વધારે ઉત્પાદન આપે છે. આ જાત મધ્યમ પાકતી, નારંગી રંગના મોટા દાણાવાળી તથા ૩૫૦ ગ્રામ ૧૦૦૦ દાણાનું વજન ધરાવે છે. આ સંકર જાતમાં ૬૬.૩૨% સ્ટાર્ચ, ૧૩.૫૩% પ્રોટીન, ૪.૪૨% તેલ, ૦.૫૪ પ્રોટીનમાં રહેલ ટ્રીપોફેન અને ૨.૬૪% પ્રોટીનમાં રહેલ લાયસીન ધરાવે છે. આ સંકર જાત પાનના સૂકારા તેમજ તળધારા રોગ સામે મધ્યમ પ્રતિકારક શક્તિ અને સામાન્ય ગેરુ રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે જ્યારે ગાલ્બમારાની ઈયળ સામે વધુ પ્રતિકારક શક્તિ ધરાવે છે.

- સહ સંશોધન વૈજ્ઞાનિક, મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર, આકૃયુ, ગોધરા -૩૮૮૦૦૧
ફોન : (૦૨૬૭૨) ૨૬૫૮૫૨ • ઈ-મેઇલ : rsmaize@gmail.com

૧.૪ દિવેલા : ગુજરાત આણંદ દિવેલા-૧૧ (જીએસી-૧૧)



મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તાર માટે દિવેલાની નવી જાત ગુજરાત આણંદ દિવેલા ૧૧ (જી.એ.સી.૧૧) પિયત તેમજ બિનપિયત માટે ભલામણ કરવામાં આવે છે. આ જાત સરેરાશ રૂરૂ ૩૫.૬ કિ.ગ્રા./હેક્ટર ઉત્પાદન આપે છે જે વાવેતર માટે ભલામણ કરેલ સ્થાનિક જાત જી.સી.૩ કરતાં ૨૬.૩ ટકા વધુ છે. જ્યારે બિનપિયત પરિસ્થિતિ હેઠળ ગુજરાત આણંદ દિવેલા ૧૧ સરેરાશ રૂરૂ ૬૫.૬ કિ.ગ્રા./હેક્ટર ઉત્પાદન આપે છે જે સ્થાનિક જાત જી.સી.૩ કરતા રૂપ.૬ ટકા વધારે છે. આ સ્થાનિક જાત ચકાસણી હેઠળની બધી જાતો કરતા વહેલી પાકે છે અને સૂકારાના રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. ત્રિષ્ણ, તડતરીયાં અને સફેદમાખીનો ઉપદ્રવ ભલામણ કરેલ દિવેલાની જાતોની સરખામણીમાં સમકક્ષ જોવા મળેલ છે.

- સહ સંશોધન વૈજ્ઞાનિક, કૃષિ સંશોધન કેન્દ્ર, આકૃયુ, સણસોલી-૩૮૭૧૩૦

ફોન : (૦૨૬૯૪) ૨૮૨૦૫૧ • ઈ-મેઈલ : sansoli@aau.in

૧.૫ ધાસચારા બાજરી : ગુજરાત આણંદ ધાસચારા બાજરી ૪ (જીએઅફબી-૪)



મધ્ય ગુજરાતના વિસ્તારમાં ખરીફ ઋતુ દરમ્યાન ધાસચારા બાજરીનું વાવેતર કરતા વિસ્તાર માટે ધાસચારા બાજરીની જાત ગુજરાત આણંદ ધાસચારા બાજરી ૪ (જીએઅફબી ૪)ની ભલામણ કરવામાં આવે છે. આ જાત ૫૮૦.૮ ક્રિ. / ડે. લીલાચારાનું ઉત્પાદન આપે છે જે જીએફબી (લોકલ અંકુશ જાત) અને જાયન્ટ બાજરા (રાષ્ટ્રીય અંકુશ જાત) કરતાં અનુક્રમે ૧૭.૮ અને ૧૩.૨ % વધારે છે. તથાઉપરાંત જીએઅફબી ૪ નું સૂક્કાચારાનું સરેરાશ ઉત્પાદન ૧૨૦.૩ ક્રિ. / ડે. છે જે જીએફબી૧ (લોકલ અંકુશ જાત) અને જાયન્ટ બાજરા (રાષ્ટ્રીય અંકુશ જાત) કરતાં અનુક્રમે ૨૦.૪ અને ૧૩.૮ % વધારે છે. આ જાતમાં કુડ પ્રોટીનનું સરેરાશ ઉત્પાદન ૮.૬૬ ક્રિ. / ડે. છે જે જીએફબી૧ (લોકલ અંકુશ જાત) અને જાયન્ટ બાજરા (રાષ્ટ્રીય અંકુશ જાત) કરતા અનુક્રમે ૩૧.૩ અને ૩૩.૪ % વધારે ગુણવત્તાની દર્શિએ આ જાત શુષ્ક પદાર્થ ૨૦.૮%, કુડ પ્રોટીન ૭.૭%, ન્યુટ્રિટ ડિટરજન્ટ ફાઈબર ૮૦.૫%, કુડ ફાઈબર ૩૦.૮% અને એસિડ ડિટરજન્ટ ફાઈબર ૪૨.૩% ધરાવે છે. આ જાતમાં છોડની ઊંચાઈ (૨૪૦.૧ સે.મી.), ફૂટની સંખ્યા

(૩.૭), પાનની સંખ્યા (૨૮.૫) પ્રતિ છોડ અને પાન : થડનો ગુણોત્તર (૦.૮) છે જે અંકુશ જાતો કરતા વધારે છે. આ જાત એક કાપણીની પ્રકૃતિ, આદ્યા લીલા રંગના પર્ણ સમૂહ અને પાતળું થડ ધરાવે છે.

- સંશોધન વૈજ્ઞાનિક, મુખ્ય ઘાસચારા સંશોધન કેન્દ્ર, આકૃયુ, આણંદ -૩૮૮૧૧૦
ફોન : (૦૨૬૮૨) ૨૬૪૧૭૮ • ઈ-મેઈલ : forageanand@gmail.com

(૨) ધાન્ય પાકો

૨.૧ ચોમાસુ ડાંગરમાં ધરુની માવજત (જાત : ગુજરી)



મધ્ય ગુજરાત ખેત આભોહવાકીય વિસ્તારમાં ચોમાસુ ડાંગરની ગુજરી જાતની ફેરરોપણી કરતા ખેડૂતોને વધુ ઉત્પાદન અને નફો મેળવવા માટે પ્રતિ હેક્ટારે ૮૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૨૦ કિ.ગ્રા. ફોર્સફર્સ ઉપરાંત મિથાયલોટ્રોફિક બેકટેરીયલ કન્સોર્ઝિયમની ૫ મિ.લિ./લિ. પાણીમાં રોપણી સમયે ધરુને ૧૫ મિનિટ માટે માવજત આપવાની તથા ૩૦ દિવસ બાદ તેનો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. તેનાથી ૨૦ ટકા નાઈટ્રોજન, ૨૦ ટકા ફોર્સફર્સની બચત થાય અને ડાંગરમાંથી વાતાવરણમાં ઉત્સર્જિત થતા મિથેન વાયુનું પ્રમાણ ધટે છે.

- સંશોધન વૈજ્ઞાનિક અને વડા, માઈકોબાયોલોજી વિભાગ, બં.અ.કુ.મ.,
આકૃયુ, આણંદ - ૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૮૨) ૨૬૦૨૧૧
ઈ-મેઈલ : rvvyas@aau.in

૨.૨ ડાંગરની ખેતીમાં લીફ કલર ચાર્ટ દ્વારા નાઈટ્રોજન વ્યવસ્થાપન

મધ્ય ગુજરાત ખેતી
આબોહવાકીય વિસ્તારમાં મધ્યમ મોડી
પાકતી ડાંગરની જાત (જીએઆર ૧૩)
નું વાવેતર કરતા ખેડૂતોને ભલામણ
કરવામાં આવે છે કે ફોર્સ્ફર્સ અને
નિંક જમીન ચકાસણી મુજબ આપવો.



ઉપરાંત નાઈટ્રોજન વ્યવસ્થાપન લીફ
કલર ચાર્ટ દ્વારા જ્યારે જ્યારે લીફ કલર ચાર્ટના કિટીકલ સ્કોર '૪' અથવા '૪' થી
ઓછો આવે ત્યારે પ્રતિ હેક્ટારે ૧૦૦ કિ.ગ્રા. નાઈટ્રોજન, ૨૦ કિ.ગ્રા.ના સરખા
હમે આપવાથી વધુ ઉત્પાદન અને નફો મેળવી શકાય છે.

- સંશોધન વૈજ્ઞાનિક, મુખ્ય ડાંગર સંશોધન કેન્દ્ર, આકૃયુ, નવાગામ -૩૮૭૫૪૦
ફોન : (૦૨૬૯૪) ૨૮૪૨૭૮ • ઈ-મેઈલ : rsrice_mrrs@yahoo.com

૨.૩ ઉનાળુ બાજરીની ખેતીમાં નીંદણ વ્યવસ્થાપન માટે વપરાતી એટ્રાઇન નીંદણનાશકની વિપરીત અસર નિવારવા છાણિયા ખાતરનો ઉપયોગ



મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તારમાં ઉનાળું બાજરી ઉગાડતા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે, વાવણી બાદ ૨૦ અને ૪૦ દિવસે આંતરખેડ અને હાથ નીંદામણ કરવું અથવા ભલામણ કરેલ એટ્રાછન નીંદણનાશક ૫૦૦ ગ્રામ પ્રતિ હેક્ટારે ગ્રી-ઇમરજન્સ ધંટકાવ કરવો. એટ્રાછનની પાક પર થતી વિપરીત અસર નિવારવા હેક્ટારે ૧૦ ટન છાણિયું ખાતર ચાસમાં વાવણી સમયે આપવું જેથી ઉત્પાદનમાં વધારા સાથે જમીનના પોષક તત્વોની જાળવણી પણ થઈ શકે છે.

- પ્રાધ્યાપક અને વડા, જમીન વિજ્ઞાન અને કૃષિ રસાયણ વિભાગ, બં.અ.કૃ.મ.,
આકૃયુ, આણંદ - ૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૫૮) ૨૨૫૭૪૨
● ઈ-મેઈલ : kcpatel@aau.in

૨.૪ શિયાળું અસ્તુમાં હાઈબ્રિડ મકાઈ પર નાઈટ્રોજન અને ફોસ્ફરસ ખાતરની અસર



ગુજરાત આણંદ પીળી સંકર મકાઈ ૧



ગુજરાત આણંદ સફેદ સંકર મકાઈ ૨

મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તારના પંચમહાલ જીલ્લામાં શિયાળું અસ્તુમાં ગુજરાત આણંદ પીળી સંકર મકાઈ ૧ અથવા ગુજરાત આણંદ સફેદ સંકર મકાઈ રનું વાવેતર કરતા ખેડૂતોને વધુ ઉત્પાદન અને નફો મેળવવા માટે હેક્ટારે ૧૫૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ પ્રતિ હેક્ટારે (ફોસ્ફરસનું મધ્યમ પ્રમાણ ધરાવતી જમીન માટે) આપવાની ભલામણ છે.

મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તારના આણંદ જીલ્લામાં શિયાળું

જ્યાનુમાં ગુજરાત આણંદ પીળી સંકર મકાઈ ૧ જાતનું વાવેતર કરતા ખેડૂતોને વધુ ઉત્પાદન અને નફો મેળવવા માટે હેક્ટરે ૧૫૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ પ્રતિ હેક્ટરે (ફોસ્ફરસની ઉણાપ ધરાવતી જમીન માટે) આપવાની ભલામણ કરવામાં આવે છે.

નોંધ : નાઈટ્રોજનને ચાર સરખા તબક્કામાં, વાવણી સમયે, ૪ પાન આવસ્થાએ, ૮ પાન અવસ્થાએ તથા ચમરી અવસ્થાએ અને ફોસ્ફરસને પાયામાં આપવો.

- સહ સંશોધન વૈજ્ઞાનિક, મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર, આકૃયુ, ગોધરા
ફોન : (૦૨૬૭૨) ૨૬૫૮૮૫૨ • ઈ-મેઈલ : rsmaize@gmail.com

૨.૫ મકાઈની ખેતીમાં ગાભમારાની દીયળનો ઉપદ્રવ અટકાવવા માટે જીની માવજત

મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તાર-૩ નાં ખેડૂતોને ગાભમારાની દીયળનો ઉપદ્રવ અટકાવવા માટે થાયામેથોક્કામ ૩૦ એફએસ ૮ મિ.લિ./કિ.ગ્રા. બીજમાં ૮ મિ.લિ. પ્રમાણે પાણી ભેળવી વાવણી પહેલાં ૧૨ કલાક બીજ માવજત આપવાની સલાહ આપવામાં આવે છે. માવજત આપેલ બિયારણને છાંયડે સૂકીવી વાવેતર માટે ઉપયોગમાં લેવા.



- મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, કૃષિ સંશોધન કેન્દ્ર, આકૃયુ, સણસોલી-૩૮૭૧૩૦
ફોન : (૦૨૬૮૪) ૨૮૨૦૫૧ • ઈ-મેઈલ : sansoli@aaau.in

૨.૬ બિનપિયત ભાલીયા ઘઉંની ખેતીમાં વધુ ઉત્પાદન માટે થાયોયુરિયાનો છંટકાવ

ગુજરાત રાજ્યના ભાલ અને દરિયાકાંઠા ખેત આબોહવાકીય વિભાગ-ના બિનપિયત ડયુરમ (ભાલીયા) ઘઉંની ખેતી કરતાં ખેડૂતોને મહત્તમ ઉત્પાદન અને વધુ આવક મેળવવા માટે થાયોયુરિયા ૫૦૦ પી.પી.એમ. (૫ ગ્રામ/૧૦ લિટર પાણી) પ્રમાણે ઘઉંની વાવણી બાદ પ્રથમ છંટકાવ ફુટ અવસ્થાએ (૩૫-૪૦ દિવસે) અને બીજો છંટકાવ ઊંભી નિકળવાના સમયે (૬૦-૬૫ દિવસે) કરવાની ભલામણ કરવામાં આવે છે.



- મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, કૃષિ સંશોધન કેન્દ્ર, આકૃયુ, ધંધુકા-૩૮૨૪૬૦
ફોન : (૦૨૭૧૩) ૨૮૩૦૧૩ • ઈ-મેઈલ : arsbhk@aau.in

(૩) કઠોળ પાકો

૩.૧ ચણાની ખેતીમાં બીજ માવજત

ચણાની ખેતી કરતા ખેડૂતો માટે ચણાની જાત જીજી-૧ અને જીજેજી-ના બીજમાં અંકુરણ વધારવા તથા છોડના તંદુરસ્ત વિકાસ માટે બીજ માવજત તરીકે બીજને પોટેશિયમ નાઈટ્રો KNO_3



જીજેજી-૩

૧૦૦ પી.પી.એમ. (૧૦૦ ભિલિગ્રામ/૧ લિ) દ્રાવજામાં વાવણી પહેલાં ૮ કલાક
પલાળી છાંખડામાં સૂકવીને વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે.

- પ્રાધ્યાપક અને વડા, સીડ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ,

બં.અ.કૃ.મ., આકૃયુ, આણંદ -૩૮૮૧૧૦

ફોન : (૦૨૬૮૮) ૨૬૦૬૮૦ • ઈ-મેઈલ : kalyan_patil@aau.in

૩.૨ ચણાના લીલા પોપટાની ખેતી માટે વાવણી સમય અને વાવણી અંતર

મધ્ય ગુજરાત ખેત
આબોહવાકીય વિસ્તારમાં લીલા
પોપટા માટે ચણા (જાત: જજ ૨) ની
વાવણી કરતા ખેડૂતોને વધુ ઉત્પાદન
અને નફો મેળવવા માટે ચણાની
વાવણી ઓક્ટોબર મહિનાના પ્રથમ
અઠવાદિયામાં ૪૫ સે.મી. X ૧૦
સે.મી.ના અંતરે કરવાની ભલામણ
કરવામાં આવે છે.



- સહ સંશોધન વૈજ્ઞાનિક, કૃષિ સંશોધન કેન્દ્ર, આકૃયુ, ડેરોલ-૩૮૮૮૨૦

ફોન (૦૨૬૭૬) ૨૫૫૫૨૮ • ઈ-મેઈલ : arsderol@gmail.com

૩.૩ તુવેરની શીંગમાખીના ઉપદ્રવ પર વાવણી સમયની અસર

મધ્ય ગુજરાત ખેત
આબોહવાકીય વિસ્તાર-ઉનાતુવેરની
જેતી કરતા ખેડૂતોને ભલામણ
કરવામાં આવે છે કે તુવેરની શીંગ
માખીનો ઉપદ્રવ ઓછો રહે તે માટે
વૈશાલી જાતની પસંદગી કરવી અને



તુવેરની વાવણી જૂનના ત્રીજા અઠવાડિયાથી જુલાઈના પ્રથમ અઠવાડિયા સુધીમાં કરવી.

- મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (કીટકશાસ્ક), કૃષિ સંશોધન કેન્દ્ર, આકૃયુ, ડેરોલ-૩૮૬૭૨૦ ફોન (૦૨૬૭૬) ૨૭૫૫૨૮ • ઈ-મેઈલ : arsderol@gmail.com

૩.૪ અર્ધ શિયાળુ મગની ખેતીમાં વાવણી સમય અને વાવણી અંતર :

મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તારના અર્ધશિયાળુ મગની ખેતી કરતા ખેડૂતોને મગનું વધુ ઉત્પાદન અને નફો મેળવવા માટે સાટેમ્બરના ત્રીજા અઠવાડિયામાં ૩૦ સે.મી.ના અંતરે હારમાં વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે.



- સંશોધન વૈજ્ઞાનિક, કઠોળ સંશોધન કેન્દ્ર, આકૃયુ, વડોદરા-૩૮૦૦૦૩ ફોન : (૦૨૬૫) ૨૭૪૭૬૮ • ઈ-મેઈલ : prsvad@aau.in

(૪) રોકડીયા પાકો

૪.૧ બિનપિયત દેશી કપાસની ખેતીમાં વાવણી અંતર

ભાલ અને દરિયાકાંઠા ખેત આબોહવાકીય વિસ્તારમાં બિનપિયત દેશી કપાસ ઉગાડતા ખેડૂતોને કપાસનું વધુ ઉત્પાદન અને નફો મેળવવા માટે ગુજરાત કપાસ ૨૧ જાતનું વાવેતર ૬૦ સે.મી. X ૩૦ સે.મી.ના અંતરે કરવાની ભલામણ કરવામાં આવે છે.



- સહ સંશોધન વૈજ્ઞાનિક, વિભાગીય કપાસ સંશોધન કેન્દ્ર, આકૃયુ, વિરમગામ-૩૮૨૧૫૦ ફોન (૦૨૭૧૫) ૨૭૦૧૪ • ઈ-મેઈલ : desicotton@aau.in

૪.૨ બીટી કપાસની ખેતીમાં પોષણ વ્યવસ્થાપન

મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તારમાં બીટી કપાસ (જાત : જીસીએચ છ) નું વાવેતર કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે કપાસનું વધુ ઉત્પાદન અને નફો મેળવવા માટે ૨૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન પ્રતિ હેક્ટર આપવો. તે પૈકી ૬૦ કિ.ગ્રા. નાઈટ્રોજન પાયામાં અને બાકીનો ૧૮૦ કિ.ગ્રા. નાઈટ્રોજન ત્રાણ સરખા ભાગમાં એક માસના અંતરે પૂર્તિ ખાતર તરીકે આપવો.



- સહ સંશોધન વૈજ્ઞાનિક, કૃષિ સંશોધન કેન્દ્ર (પિયત પાકો), આકૃયુ, ઢાસરા-૩૮૮૨૫૦ ફોન : (૦૨૬૬૮) ૨૨૨૧૦૨
ઈ-મેઈલ : araaaauthasra@aau.in

૪.૩ ટપક સિંચાઈ દ્વારા બીટી કપાસની ખેતીમાં ટોચ કાપણી અને ખાતર

મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તારના ભારે કાળી જમીનમાં બીટી કપાસનું ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવીને વાવેતર કરતા ખેડૂતોને ઓદ્ધા ખર્ચ વધુ ઉત્પાદન મેળવવા માટે કપાસના પાકને ૧૦૦ દિવસે છોડની ટોચ કાપવાની તથા પ્રતિ હેક્ટરે ૨૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન ચાર સરખા હમામાં એટલે કે ૬૦ કિ.ગ્રા. નાઈટ્રોજન પાયામાં અને બાકીનો ૧૮૦ કિ.ગ્રા. નાઈટ્રોજન ત્રાણ સરખા હમામાં એક માસના અંતરે ટપક પદ્ધતિ દ્વારા આપવા ભલામણ કરવામાં આવે છે.



- મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, નર્મદા પિયત સંશોધન કેન્દ્ર, આકૃયુ, ખાંધા-૭૮૧૨૪૦ ફોન : (૦૨૬૬૬) ૨૨૦૨૭૪ • ઈ-મેઈલ : nirp@aau.in

૪.૪ બીટી કપાસની ખેતીમાં ગુલાબી ઈયળનું ફેરોમોન ટ્રેપ દ્વારા નિયંત્રણ

મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તાર-તમાં બીટી કપાસની ખેતી કરતા ખેડૂતોને ગુલાબી ઈયળના અસરકારક અને અર્થક્ષમ વ્યવસ્થાપન માટે ફૂલ અવસ્થાના એક અઠવાડીયા પહેલા ૪૦ ફેરોમોન ટ્રેપ પ્રતિ હેક્ટર છોડની ઊંચાઈથી ૩૦ સે.મી. ઉપર રહે તે રીતે સરખા અંતરે ગોઠવવા તથા તેની લ્યુર એક મહિનાના અંતરે છેલ્લી વીણી સુધી બદલવાની સલાહ આપવામાં આવે છે.



- પ્રાધ્યાપક અને વડા, કીટકશાસ્ક વિભાગ, બં.અ.કુ.મ., આકૃયુ, આણંદ-૭૮૮૧૧૦ ફોન : (૦૨૬૮૨) ૨૨૫૭૧૩ • ઈ-મેઈલ : pkb5458@aau.in

(૫) મરીમસાલા પાકો :

૫.૧ જીરાની ખેતીમાં ફૂગનાશકના છંટકાવ દ્વારા ચરમી રોગનું વ્યવસ્થાપન

મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તાર-૩ ના જીરની ખેતી કરતા ખેડૂતોને ચરમી રોગના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે રોગની શરૂઆત થયેથી એઝોક્સીસ્ટ્રોબીન ૨૩ એસસી ૦.૨૩% (૧૦ મિ.લિ./૧૦ લિટર પાણી) પ્રમાણેનો પહેલો છંટકાવ અને બાકીના બે છંટકાવ ૧૦ ટિવસના અંતરે કરવાની સલાહ આપવામાં આવે છે.



- પ્રાધ્યાપક અને વડા, વનસ્પતિ રોગશાસ્ક વિભાગ, બં.અ. કુ.મ., આકૃયુ, આણંદ-૭૮૮૧૧૦ ફોન : (૦૨૬૮૨) ૨૬૨૪૪૫ • ઈ-મેઈલ : abbrahmbhatt@aau.in

(૬) તેલીબિયા પાકો :

૬.૧ ખરીફ અસ્તુમાં સોયાબીની ખેતીમાં જિયારણનો દર

મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તારના સોયાબીનની ખેતી કરતા ખેડૂતોને વધારે ઉત્પાદન અને નફો મેળવવા માટે સોયાબીનની એનઆરસી ત૭ અથવા જેનેસ ઉત્પાદ જાતના જિયારણનો દર ૮૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર રાખી વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે.



- સંશોધન વૈજ્ઞાનિક, આદિવાસી સંશોધન-વ-તાલીમ કેન્દ્ર, આકૃયુ, દેવગઢભારીયા-૩૮૮૩૮૦ ફોન : (૦૨૬૭૮) ૨૨૦૨૬૧
ઈ-મેઈલ : trtcdbaaau@gmail.in

૬.૨ ખરીફ અસ્તુમાં સોયાબીનની ખેતીમાં વાવણી અંતર

મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તારના સોયાબીનની ખેતી કરતા ખેડૂતોને વધારે ઉત્પાદન અને નફો મેળવવા માટે સોયાબીનની એનઆરસી ત૭ અથવા જેનેસ ઉત્પાદ જાતના ૪૫ સે.મી.ના અંતરે વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે.



- સંશોધન વૈજ્ઞાનિક, આદિવાસી સંશોધન-વ-તાલીમ કેન્દ્ર, આકૃયુ, દેવગઢભારીયા-૩૮૮૩૮૦ ફોન : (૦૨૬૭૮) ૨૨૦૨૬૧
ઈ-મેઈલ : trtcdbaaau@gmail.in

(૭) શાકભાજુ પાકો

૭.૧ મરચીમાં નાઈટ્રોજન વ્યવસ્થાપન

(જાત : જુઅનીસીઅય ૧)

મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તાર- ઉમાં સંકર મરચીની ખેતી કરતા ખેડૂતોને સલાહ



આપવામાં આવે છે કે ૭૦ કિ.ગ્રા. નાઈટ્રોજન, ૫૦ કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૫૦ કિ.ગ્રા. પોટાશ પાયામાં અને બાકીનો ૭૦ કિ.ગ્રા. નાઈટ્રોજન બે સરખા હમામાં ફેરરોપણી બાદ ૩૦ અને ૬૦ દિવસે આપવાથી વધુ ઉત્પાદન અને આવક મેળવી શકાય છે.

- સંશોધન વૈજ્ઞાનિક, મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર, આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦
ફોન : (૦૨૬૬૨) ૨૬૦૨૫૧ • ઈ-મેઈલ : rsmvrs@aau.in

૭.૨ ટામેટીમાં ખાતર વ્યવસ્થાપન (જાત : એટી ૩)

મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તાર-ઉમાં ટામેટી (એટી ૩) ની ખેતી કરતા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે. કે ૬૨.૫ કિ.ગ્રા. નાઈટ્રોજન, ૫૦ કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૫૦ કિ.ગ્રા. પોટાશ પાયામાં અને બાકીનો ૬૨.૫ કિ.ગ્રા. નાઈટ્રોજન બે સરખા હમામાં ફેરરોપણી બાદ ૩૦ અને ૬૦ દિવસે આપવાથી વધુ ઉત્પાદન અને આવક મેળવી શકાય છે.



- સંશોધન વૈજ્ઞાનિક, મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર, આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦
ફોન : (૦૨૬૬૨) ૨૬૦૨૫૧ • ઈ-મેઈલ : rsmvrs@aau.in

૭.૩ ભીડાની ખેતીમાં દુંખ અને ફળ કોરી ખાનાર ઈયળનું વ્યવસ્થાપન

મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તાર-ઉના ભીડાની ખેતી કરતા ખેડૂતોને ભીડાની દુંખ અને ફર્દા કોરી ખાનાર ઈયળના અર્થક્ષમ અને અસરકારક નિયંત્રણ માટે નીચે મુજબના મોડચુલને અનુસરવાની સલાહ આપવામાં આવે છે.

(૧) ભીડાના બીજને ઈમીડાકલોપ્રીડ ૬૦૦ એફ.એસ. ૮ મિ.લિ. /કિ.ગ્રા. પ્રમાણે સપ્રમાણ પાણી ખેતીવી વાવણીના ૧૨ કલાક પહેલા બીજ માવજત આપવી.

(૨) કુંખ અને ફળ કોરી ખાનાર ઈયળ દ્વારા નુકસાન પામેલ કુંખ અને ફળ ઈયળ સહિત તોડીને તેનો નાશ કરવો.



(૩) ભીડાની વાવણી ગણ અઠવાડીયા બાદ કુંખ અને ફળ કોરી ખાનાર ઈયળના નર ફૂંદાને આકર્ષવા ૬૦ ફેરોમોન ટ્રેપ/હેક્ટરે ગોઠવવા અને તેની વ્યુર દર ૨૧ દિવસે બદલવી.

(૪) કલોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫ એસ.સી. ૦.૦૦૬ % (૩ મિલિ/૧૦ લિટર પાણીમાં) વાવણી બાદ ૨૫ દિવસે છંટકાવ કરવો. (૩૦ ગ્રા.સ.ત./હે.)



(૫) લીંબોળીના મીજમાંથી બનાવેલ ૫%નો અર્ક (૫૦૦ ગ્રામ મીજનો ભૂકો/૧૦ લિટર પાણી) વાવણી બાદ ૨૫ દિવસે છંટકાવ કરવો.



(૬) એમામેકટીન બેન્જોએટ ૫ એસ.શ ૦.૦૦૨૫% (૫ ગ્રામ/૧૦ લિટર પાણીમાં) (૧૨.૫ ગ્રા.સ.ત./હે.) નો છંટકાવ કરવો.

(૭) બીટી પાઉડર ૫ ડબ્લ્યુપી (૧૦ ગ્રામ/૧૦ લિટર પાણીમાં) નો ૫૫ દિવસે છંટકાવ કરવો.

(૮) લીંબોળીના મીજમાંથી બનાવેલ ૫%નો અર્ક (૫૦૦ ગ્રામ મીજનો ભૂકો/૧૦ લિટર પાણી) નો રોપણીના ૬૫ દિવસે છંટકાવ કરવો.

- મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (કીટકશાસ્ક), મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર, આકૃય, આણંદ-૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૬૨) ૨૬૦૨૫૧ • ઈ-મેઈલ : rsmvrs@aau.in

૭.૪ ભીડાની ખેતીમાં બાયોએજન્ટ દ્વારા ગંઠવા ફૂમિનું વ્યવસ્થાપન

મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તાર-૩ ના ચોમાસુ ભીડાની ખેતી કરતા ખેડૂતોને ગંઠવા ફૂમિના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે

પરપુરીયોસિલિયમ લીલાસિનમ
 (૨ X ૧૦^६ સીએફ્યુ/મિ.લિ.) ની
 બીજને ૫ મિ.લિ./કિ.ગ્રા. પ્રમાણે
 માવજત આપવી તથા ૧૦ મિ.લિ./
 કિ.ગ્રા. પ્રમાણે પરપુરીયોસિલિયમ
 લીલાસિનમ ફૂગથી સંવર્ધિત કરેલ
 વર્મિકમ્પોસ્ટ ૨૫ ટન/ઝે. પ્રમાણે
 વાવણી પહેલાં જમીનમાં આપવાની
 સલાહ આપવામાં આવે છે.



- ગ્રાધ્યાપક અને વડા, કૃમિશાસ્ત્ર વિભાગ, બં. અ. કૂ.મ., આકૃયુ,
 આણંદ -૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૬૨) ૨૬૨૮૫૦ • ઈ-મેઈલ : bapatel@aau.in

૭.૫ બટાટાની ખેતીમાં રોપણી સમય

મધ્ય ગુજરાત ખેત આભોહવાકીય વિસ્તાર-ઉમાં બટાટા (જાત : કુફરી
 પુખરાજ, કુફરી બાદશાહ અને કુફરી લૌકર) ની રોપણી કરતા ખેડૂતોને વધુ આવક
 અને નફો મેળવવા માટે બટાટાનું વાવેતર નવેમ્બર માસના બીજા અઠવાડીયાથી
 ચોથા અઠવાડીયા સુધીમાં કરવા સલાહ આપવામાં આવે છે.



- સંશોધન વૈજ્ઞાનિક, મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર,
 આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૬૨) ૨૬૦૨૫૧
 ઈ-મેઈલ : rsmvrs@aau.in

(૮) ધાસચારા પાકો

૮.૧ રજકાના બીજ ઉત્પાદનની ખેતીમાં બોરોન અને કાપણી વ્યવસ્થાની અસર

મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તારમાં રજકા (આણંદ-૨)નું બીજ ઉત્પાદન કરતા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે વધુ ઉત્પાદન અને નફો મેળવવા માટે ભલામણ કરેલ ખેતી પદ્ધતિની



સાથે રજકાના પાકને ફેલ્બુઅારી માસના ત્રીજા કે ચોથા અઠવાડીયામાં લીલા ચારાની છેલ્ટ્વી કાપણી બાદ બીજ ઉત્પાદન માટે છોડી ટેવો. ત્યારબાદ ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે ૦.૦૨ ટકા બોરોનના દ્રાવણનો પ્રથમ છંટકાવ કરવો તથા બીજો છંટકાવ પ્રથમ છંટકાવના ૧૦ દિવસ બાદ કરવો, અને તમામ ભલામણ કરેલ ખેત પદ્ધતિઓ અપનાવવાથી વધુ બીજ ઉત્પાદન અને ચોખ્યો નફો મેળવી શકાય છે.

- સંશોધન વૈજ્ઞાનિક, મુખ્ય ધાસચારા સંશોધન કેન્દ્ર, આકૃય, આણંદ-૩૮૮૧૧૦ ફોન (૦૨૬૮૨) ૨૬૪૧૭૮ • ઈ-મેઈલ : forageanand@gmail.com

૮.૨ શિયાળામાં બિનપિયત ધાસચારાની જુવારની ખેતીમાં ગાભમારાની દ્યાટ અને વાયરવર્મનું નિયંત્રણ

મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તાર એના બિનપિયત ધાસચારાની જુવાર ઉગાડતા ખેડૂતોને



ગાભમારાની ઈયળ અને વાયરવર્મના ઉપદ્રવને અટકાવવા માટે બીજને થાયામેથોક્ઝામ ૩૦ એફએસ ૮ મિ.લિ/ક્રિ.ગ્રા.ની સહ પ્રમાણ પાણી ભેળવી વાવણીના ૧૨ કલાક પહેલા બીજ માવજત આપીને છાંયડે સૂકવી વાવણી કરવા ભલામણ કરવામાં આવે છે.



- સહ સંશોધન વૈજ્ઞાનિક, કૃષિ સંશોધન કેન્દ્ર, આકૃયુ, અરણોજ-૩૮૨૨૩૦
ફોન : (૦૨૭૧૪) ૨૮૪૨૦૩ • ઈ-મેઈલ : arsarnej@aau.in

૮.૩ ગીની ઘાસની ખેતીમાં ઉત્પાદન અને ગુણવત્તા પર નાઈટ્રોજનની અસર

મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તારના ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે ગીની ઘાસના લીલા ચારાનું ગુણવત્તાસભર વધુ ઉત્પાદન અને વધુ નફો મેળવવા માટે સીઓ (જી) ત જાતનું વાવેતર કરી કાપણી બાદ પ્રતિ હેક્ટરે ૫૦ કિ.ગ્રા.



નાઈટ્રોજન ત્રણ વર્ષ સુધી આપવો. (વધુમાં પાયામાં ૧૦ ટન છાણિયું ખાતર, ૫૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ પ્રતિ હેક્ટરે આપવું.)

- સંશોધન વૈજ્ઞાનિક, મુખ્ય ઘાસચારા સંશોધન કેન્દ્ર, આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦
ફોન (૦૨૬૮૨) ૨૬૪૧૭૮ • ઈ-મેઈલ : forageanand@gmail.com

(૬) ઔષધિય પાકો

૬.૧ તુલસીની ખેતીમાં ઉત્પાદન અને ગુણવત્તા પર છાણિયા ખાતરની અસર



મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તારમાં સેન્ટ્રિય ખાતર દ્વારા ચોમાસું તુલસીનું વાવેતર કરવા ઈશ્છુક ખેડૂતોને સૂકા પંચાંગ (પાન)નું વધુ ઉત્પાદન અને નફો મેળવવા માટે પ્રતિ હેક્ટરે ૧૫ ટન છાણિયું ખાતર આપવાની ભલામણ કરવામાં આવે છે.

- સહ સંશોધન વૈજ્ઞાનિક , ઔષધિય અને સુગંધિત પાક સંશોધન કેન્દ્ર, આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૮૨) ૨૬૧૪૮૨
ઈ-મેઇલ : mapanand2008@gmail.com

૬.૨ ડોડીની ખેતીમાં સૂકા ઉત્પાદન પર નાઈટ્રોજન અને ફોસ્ફરસ ખાતરની અસર

મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તારમાં ચોમાસામાં ડોડી પાકનું વાવેતર કરતા ખેડૂતોને ડોડીના વધુ સૂકા પંચાંગ (પાન વેલા સહિતના સૂકો છોડ)ના ઉત્પાદન અને નફો મેળવવા માટે હેક્ટરે ૨૦૦



કિ.ગ્રા. નાઈટ્રોજન આપવો જે પૈકી પ૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૨૫ કિ.ગ્રા. ફોસ્ફરસ પાયામાં તથા બાકીનો ૧૫૦ કિ.ગ્રા. નાઈટ્રોજન, ત્રાણ સરખા હમામાં રોપણી બાદ ૪૫ દિવસે, ૬૦ દિવસે (પ્રથમ કાપણી) અને ૧૮૦ દિવસે (બીજી કાપણી બાદ) આપવો. તેનાથી સૂક્ષ્મ પદાર્થનું વધુ ઉત્પાદન (મૂળ સિવાયનો સૂક્ષ્મ છોડ) અને ચોખ્ખો નફો મેળવી શકાય છે.

- સહ સંશોધન વૈજ્ઞાનિક, ઔષધિય અને સુગંધિત પાક સંશોધન કેન્દ્ર,
આકૃયુ, આંશંદ-૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૮૮) ૨૬૧૪૮૨
ઈ-મેઈલ : mapanand2008@gmail.com

(૧૦) ફળ પાકો

૧૦.૧ જામફળની ખેતીમાં ફર્ટિગેશન દ્વારા પોષણ વ્યવસ્થાપન

મધ્ય ગુજરાત ખેત
આબોહવાકીય વિસ્તાર-૩માં
ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી
જામફળની ખેતી કરતા ખેડૂતોને
ઝડપ દીઠ ૩૭૫-૧૮૮-૧૮૮ ગ્રામ
એન.પી.કે. પાણીમાં દ્રાવ્ય ખાતર



(જેના માટે ઝડપ દીઠ એન.પી.ગ્રેડ ૩૧૦ ગ્રામ, યુરિયા ૭૪૦ ગ્રામ અને ભ્યુરેટ ઓફ પોટાશ ૩૧૫ ગ્રામ) ચાર સરખા હમામાં જૂન અને સપ્ટેમ્બર મહિનાના બીજા અને ચોથા સપ્તાહમાં આપવા ભલામણ છે જેનાથી ખાતરની ૨૫ ટકા જેટલી બચત થાય છે.

- સહ સંશોધન વૈજ્ઞાનિક, કૃષિ સંશોધન કેન્દ્ર (પિયત પાકો), આકૃયુ,
ઠાસરા -૩૮૮૨૫૦ ફોન : (૦૨૬૮૮) ૨૨૧૦૨
ઈ-મેઈલ : araaaauthasra@aau.in

(૧૧) ફૂલ પાકો

૧૧.૧ દેશી લાલ ગુલાબના ઉત્પાદન પર જીવ્બોલિક એસિડ અને ખાતરની અસર

મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિભાગ-ઉમાં દેશી લાલ ગુલાબની ખેતી કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે ગુલાબના પાકમાં છાંટણી (ઓક્ટોબર માસમાં) કર્યા પછી ૩૦ દિવસે અને ૬૦ દિવસે છોડ ઉપર

૧૫૦ મિલિગ્રામ પ્રતિ લિટર જીવ્બોલિક એસિડનો છંટકાવ કરવાથી તેમજ ભલામણ મુજબના ખાતરનો (૩ કિલો/છોડ છાંટણું ખાતર પાયામાં છાંટણી કર્યા પછી ૪૦:૪૦:૨૫ ગ્રામ ના.ફો.પો. અને ૧ મિ.લિ. એઝોસ્પીરીલમ અને ૧ મિ.લિ. પીએસબી/લિટર પાણીમાં પ્રતિ છોડ ગ્રાણ સરખા ભાગે જૂન, ઓક્ટોબર તથા જાન્યુઆરીમાં જમીનમાં આપવા) ઉપયોગ કરવાથી વધુ ઉત્પાદન અને નફો મેળવી શકાય છે તેમજ ફૂલોની તાજગીનો સમય વધે છે.

- ગ્રાધ્યાપક અને વડા, બાગાયત વિભાગ, બં.અ.કૂ.મ., આકૃયુ,
આણંદ-૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૯૨) ૨૬૦૨૫૦
ઈ-મેઇલ : shahnitin1968@aau.in

૧૧.૨ વર્ષાયુ સફેદ સેવંતી (વિજળી)ની ખેતીમાં સંકલિત પોષણ વ્યવસ્થાપનની ઉત્પાદન પર અસર

મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તાર-ઉમાં વર્ષાયુ સેવંતી (વિજળી) ની ખેતી કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે. કે, હેક્ટર ૫ ટન છાંટણું ખાતર તેમજ ૭૫:૧૦૦:૫૦ ડિ.ગ્રા. ના.ફો.પો. પ્રતિ હેક્ટર પાયામાં આપવું.





ધરુની ફેરરોપણી પહેલા મૂળને બાયો એન.પી.કે. કોન્સર્ટિયમ પ મિ.લિ./લિટર પાણીમાં ૨૦ મિનિટ બોળી રાખવા. બાકીનો ૭૫ કિલો નાઈટ્રોજન ધરુની ફેરરોપણી પછી ૩૦ દિવસે આપવાથી વધુ ઉત્પાદન અને નક્કો મળે છે.

- પ્રાધ્યાપક અને વડા, બાગાયત વિભાગ, બં.અ.કૂ.મ., આકૃયુ.,
આણંદ -૩૮૮૧૧૦ ફોન: (૦૨૬૬૨) ૨૬૦૨૫૦
ઈ-મેઇલ: shahnitin1968@aau.in

(૧૨) ડેરી વિજ્ઞાન

૧૨.૧ કાર્બોનેટેડ લાઈમ વ્હે બેવરેજ બનાવવાની પદ્ધતિ

આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા કાર્બોનેટ લાઈમ વ્હે. બેવરેજ બનાવવાની પદ્ધતિ વિકસાવેલ છે જેમાં ડિ-ફેટેડ લેકટોજલાઈટ્રોલાઈઝ વ્હેમાં ૪.૫ % લાઈમનો રસ (બ્રિક્સ/એસિડનું પ્રમાણ ૧.૩) તથા ૮ થી ૧૦ % ખાંડના ઉપયોગની ભલામણ કરવામાં આવે છે. ઉપરાંત કાર્બોનેટેડ લાઈમ વ્હે બેવરેજના સ્વાદમાં સુધારો કરવા માટે તેમાં ૦.૫ % મીઠું તથા ૦.૫ % આદુનો પાઉડર ઉમેરી ૧.૫ કિ.ગ્રા./સેમીના

દબાણો કાર્બોનેશન કરવાની પણ ભલામણ કરવામાં આવે છે. ભલામણ મુજબ બનાવેલ કાર્બોનેટેડ લાઈમ વ્હે-બેવરેજને પેટ (PET) બોટલમાં ૧૦૦ પી.પી. એમ. સોડિયમ બેન્જોએટ પ્રિઝર્વેટિવ ઉમેરી ફીજના તાપમાને ($7\pm 2^{\circ}\text{C}$) ૭૫ દિવસ અને $37\pm 2^{\circ}\text{C}$. તાપમાને ૨૧ દિવસ સુધી સાચવણી કરી શકાય છે.

- પ્રાધ્યાપક અને વડા, ડેરી ટેકનોલોજી વિભાગ, ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલય,
આકૃયુ, આણંદ ફોન : (૦૨૬૮૨) ૨૨૫૮૪૪૩ • ઈ-મેઈલ : principaldsc@aau.in

૧૨.૨ લીંબુ ફ્લેવર્ડ પેઠા આઈસ્કીમ બનાવવાની પદ્ધતિ

આણંદ કૂષિ યુનિવર્સિટી દ્વારા મૂલ્ય વર્ધિત નવીન લીંબુ ફ્લેવર્ડ પેઠા આઈસ્કીમ બનાવવાની પદ્ધતિ વિકસાવેલ છે જેમાં આઈસ્કીમ મિક્સના વજનના ૧૩ % ખાંડ, ૦.૭ મિ.લિ./લિ. લીંબુનું સુગંધિત દ્વય અને ૮ % પેઠાના પતીકા ઉમેરવાની ભલામણ છે.



- પ્રાધ્યાપક અને વડા, ડેરી ટેકનોલોજી વિભાગ, ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલય,
આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૮૨) ૨૨૫૮૪૪૩
ઈ-મેઈલ : principaldsc@aau.in

૧૨.૩ રવા બરફી બનાવવાની પદ્ધતિ

આણંદ કૂષિ યુનિવર્સિટી દ્વારા રવા બરફી બનાવવાની પદ્ધતિ વિકસાવવામાં આવેલ છે. આ પદ્ધતિ દ્વારા ડયુરેમ (ભાલીયા પ્રકારના ઘઉં) નો સ્મોલ પાર્ટિકલ ગ્રેડ રવો, માવો અને



પ્રવાહી ગ્લુકોઝનો ઉપયોગ કરીને બનાવેલ રવા બરફીમાં આશરે ૧૦% રેસા, ૮.૫% પ્રોટીન, ૧૮.૫% ફેટ તથા ૪૦૪ કેલરી પ્રતિ ૧૦૦ ગ્રામ રહેલ છે. આ રવા બરફીને અગાઉથી જીવાણુ રહિત કરેલ પોલીથીન બોક્ષમાં મૂકી પોલીઈથીલીન/લો ડેસ્સિટી પોલીઈથીલીન કમ્પોઝીટ પાઉચમાં પેક કરી 30 ± 20 સે. તાપમાને ૮ દિવસ સુધી તથા 7 ± 2 સે. તાપમાને ૩૫ દિવસ સુધી સંગ્રહી શકાય છે.

- પ્રાધ્યાપક અને વડા, ડેરી ટેકનોલોજી વિભાગ, ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલય,
આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૬૨) ૨૨૫૮૪૪
ઈ-મેઈલ : principaldsc@aau.in

૧૨.૪ ચક્કા આધારિત સરગવાની ડીપ (ચટણી) બનાવવાની પદ્ધતિ

આણંદ કૂષિ યુનિવર્સિટી દ્વારા ચક્કા આધારિત સરગવાની ડીપ (ચટણી) બનાવવાની એક પદ્ધતિ વિકસાવવામાં આવેલ છે જેમાં ૫ % લેખે સરગવાના સિંગનો પાઉડર (૧૦૦ મેશ) ઉમેરવામાં આવેલ છે. ચક્કા આધારિત સરગવાની ડીપનો



સ્વાદ ૦.૫% મસાલાના મિશ્રણ

(આમચૂર પાઉડર, ફૂટીનો, આદુ તથા મરી પાઉડરનો મિશ્રણ) ઉમેરીને સુધારી શકાય છે. ચક્કા આધારિત સરગવાની ડીપને રીકલોઝેબલ પોલીપોપીલીન કો-પોલીમર કપમાં ભરી 4 ± 2 સે. તાપમાને ૧૫ દિવસ સુધી સાચવણી કરી શકાય છે.

- પ્રાધ્યાપક અને વડા, ડેરી ટેકનોલોજી વિભાગ, ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલય,
આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૬૨) ૨૨૫૮૪૪
ઈ-મેઈલ : principaldsc@aau.in

૧૨.૫ ઓછી ચરબીવાળા છન્ના બનાવવાની પદ્ધતિ

આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઓછી ચરબીવાળા છન્ના બનાવવાની પદ્ધતિ વિકસાવવામાં આવેલ છે જેમાં ૦.૨ % WPC અને ૦.૦૫ % લેસિથિન ઉમેરવાની ભલામણ છે. આ પ્રમાણે બનાવેલ છન્નામાં સામાન્ય છન્નામાં પ્રમાણમાં ૩૩ % ઓછી ચરબી અને ૨૦ % વધારે પ્રોટીન હોય છે. સદર છન્ના, સામાન્ય છન્નાની સરખામણિએ સસ્તો પણ છે તેમજ તેનો સ્વાદ સામાન્ય છન્ના જેવો જ હોય છે.



- પ્રાધ્યાપક અને વડા, ડેરી ટેકનોલોજી વિભાગ, ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલય,
આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૯૨) ૨૨૫૮૪૩
ઈ-મેઈલ : principaldsc@aau.in

૧૨.૬ ઘીનો બગાડ ઓછો કરવામાં રસોઈમાં વપરાતા મસાલાનો ઉપયોગ

સામાન્ય રીતે રસોઈમાં વપરાતા મસાલા (કાળા મરી, એલચી, તજ, લવિંગ, ધાણા, જરૂ, વરિયાળી, મેથી, આંદુ, જાયફળ અને હળદર) પૈકી જાયફળ, ઘીની અપેક્ષિત ઉપજના ૦.૫ ટકા લેખે, પીગળેલ માખણમાં અથવા ૦.૪ ટકા લેખે ૮૦ ટકા ફેટ ધરાવતા માખણમાં ઉમેરવાથી ઓક્સિડેશનથી થતો ઘીનો બગાડ ઓછો કરવામાં સૌથી વધુ અસરકારક છે.



- પ્રાધ્યાપક અને વડા, ડેરી કેમેસ્ટ્રી વિભાગ, ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલય,
આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૯૨) ૨૬૪૧૭૦
ઈ-મેઈલ : principaldsc@aau.in

૧૨.૭ ચેડાર ચીજ વ્લેનો ઉપયોગ કરી લેકટિક એસિડ બેકટેરીયાના બાયોમાસ ઉત્પાદન માટે માધ્યમ બનાવવાની પદ્ધતિ

ચેડાર ચીજ વ્લેનો ઉપયોગ કરી લેકટિક એસિડ બેકટેરીયા (લેકટોબેસિલસ હેલવેટિક્સ અને MTCC 5463 અને સ્ટ્રેપોકોક્સ થર્મોફિલસ MTCC 5461) ના બાયોમાસના ઉત્પાદન માટેનું માધ્યમ વિકસાવવામાં આવેલ છે. આવા માધ્યમનો ઉપયોગ કરીને ૫ લિટર ક્ષમતાવાળા ફર્મેન્ટરમાં, ૩૭૦સે. તાપમાને, ૧૨ કલાકમાં લેકટોબેસિલસ હેલવેટિક્સ MTCC 5463 અને સ્ટ્રેપોકોક્સ થર્મોફિલસ MTCC 5461 નો અનુક્રમે ૫.૫૧ અને ૨.૫૬ ગ્રામ/લિટર બાયોમાસ ઉત્પાદન કરી શકાય છે. આ બાયોમાસ દહી અને ધાશ બનાવવા માટે સંતોષકારક માલૂમ પડેલ છે. વિકસાવેલ પદ્ધતિની વિગત ફ્લો ચાર્ટમાં દર્શાવેલ છે.

ચેડાર ચીજ વ્લેને ૭૫૦સે. તાપમાને ૧૦ મિનિટ માટે ગરમ કરવું



ડબલ્યુપીસી (WPC-૭૦)ને ૦.૫ %ના દરે ઉમેરવું



પ્રોટીયોલીસિસ કરવા પેપેનના (૦.૫ %) ના દ્રાવણ સાથે ૫૦૦સે. તાપમાને ૪ કલાક માટે રાખવું



ત્યારબાદ ૮૫૦સે. તાપમાને ૧૦ મિનિટ માટે ગરમ કરવું



મેંગેનિઝ સલ્ફેટ ($MnSO_4$ ૦.૦૧ %) અને ઓલિક એસિડ (૦.૧ %)ને ઉમેરવા



માધ્યમને ઓટોકલેવ દ્વારા સ્ટરીલાઇઝ કરવું

- ગ્રાધ્યાપક અને વડા, ડેરી કેમેસ્ટ્રી વિભાગ, ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલય,
આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૬૨) ૨૬૪૧૭૦
ઈ-મેઈલ : principal@sc.aau.in

૧૨.૮ દૂધમાં ભેળસેળ કરવા માટે વપરાતા સામાન્ય પદાર્થોને ગુણાત્મક કસોટીઓ દ્વારા તપાસવા માટે પદ્ધતિઓ

દૂધમાં ભેળસેળ કરવા માટે વપરાતા સામાન્ય પદાર્થોને ગુણાત્મક કસોટીઓ દ્વારા તપાસવા માટે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા સુધારેલ પદ્ધતિઓ વાપરવા માટે ભલામણ કરવામાં આવે છે. આ પદ્ધતિઓનો ઉપયોગ કરવાથી કેટલાક મહત્વના ફાયદા થાય છે જેવા કે કસોટીના પારિણામ બાબતે નિર્ણય લેવામાં સરળતા, કસોટીની સંવેદનશીલતામાં સુધારો (ન્યૂનતમ મર્યાદામાં ઘટાડો), સ્વાસ્થ્ય માટે કેટલાક હાજરીએ તેમજ પર્યાવરણને પ્રદૂષિત કરતા રસાયણોનો ઉપયોગ નિવારી શકાય અને/અથવા પ્રતિબંધિત રસાયણોનો ઉપયોગ નિવારી શકાય છે. ભેળસેળ કરવા માટે વપરાતા પદાર્થો અને તેમને તપાસવા માટેની કસોટીઓની યાદી કોઈમાં દર્શાવીલ છે.

ક્રમ	ભેળસેળમાં વપરાતા પદાર્થ	આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલ સુધારેલ કસોટીઓ
૧	ડીટરજન્ટ	મીથીલીન બલ્યુ કસોટી (Methylene blue test, Paradkar et al., 2000)
૨	યુરિયા	ડીએમએબી કસોટી (DMAB test, FSSAI, 2015)
૩	એમોનિયમ સોલ્ટ	ફીનોલ કસોટી (Phenol test, FSSAI, 2015)
૪	શુકોઝ	સેલીવાનાઓફ કસોટી (Seliwanoff test, Srivastava, 2010)
૫	ગલુકોઝ	બારફોઇડ કસોટી (Barfoed test, Barfoed, 1873)
૬	માલ્ટોડેક્સ્ટ્રીન	આયોડિન કસોટી (Iodine test, Sharma et al., 2012)
૭	સ્ટાર્ચ	આયોડિન કસોટી (Iodine test, BIS, 1960)
૮	જીલેટિન	પિક્રિક એસિડ કસોટી (Picric acid test, DGHS, 2005)
૯	સોલ્ટ	ક્રોમેટ કસોટી (Chromate test, FSSAI, 2015)
૧૦	નાઇટ્રેટ	ડાયફીનાઈલએમાઈન કસોટી (Diphenylamine test, FAO, 1986)
૧૧	સર્ફેટ	બેરિયમ કલોરાઇડ ટેસ્ટ (Barium chloride test, FSSAI, 2015)

ક્રમ	ભેળસેળમાં વપરાતા પદાર્થ	આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલ સુધારેલ કસોટીઓ
૧૨	હાઇફ્રોજન પેરોક્સાઈડ	ફીનાઈલેનેડાયેમાઈન કસોટી (p-Phenylenediamine, Draaiyer et al., 2009)
૧૩	ફોર્માલિહાઈડ	(૧) લીચ કસોટી - (Leach test, BIS, 1961) (૨) હેહનેર કસોટી - (Hehner test, Draaiyer et al., 2009)
૧૪	ન્યુટ્રાલાઈઝર્સ	(૧) રોસોલિક એસિડ કસોટી (Rosolic acid test, DGHS, 2005) (૨) મિથેનોલ કસોટી (Methanol test, Davies, 1938)

- પ્રાધ્યાપક અને વડા, તેરી કેમેસ્ટ્રી વિભાગ, તેરી વિજ્ઞાન મહાવિદ્યાલય,
આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૬૨) ૨૬૪૧૭૦
ઈ-મેઈલ : principaldsc@aau.in

૧૨.૬ સીનબાયોટિક શરબત કેન્દીની બનાવવાની તાંત્રિકતા

આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા સીનબાયોટિક કેન્દીની તાંત્રિકતા વિકસાવેલ છે જેમાં ૪૪% પનીર છે, ૪% કુકટોઓલીગોસેકેરાઈડ, ૧૫% ખાંડ, ૧૦% ગ્રવાહી જ્વલુકોઝ, ૩% કુકટોઝ, ૦.૦૭% કેરાગીનન, ૦.૧૦% લોકસ્ટબીનગમ, ૦.૧૩% પ્રેકટીન, ૧૫% કેરીનો પલ્ય અને પ્રોબાયોટિક કલ્યર લેકટોબેસિલસ રામનોસસ અને લેકટોબેસિલસ પેરાકેસીઈ (૧:૧ પ્રમાણે)@ ૦.૦૩% મિશ્રણ પ્રમાણ ઉપર ઉમેરવામાં આવેલ છે. આ કેન્દી બાયએક્શિઅલી ઓરીએન્ટેડ પોલીપ્રોપીલીન મટીરિયલમાં પેક કરીને $-18 \pm 2^{\circ}\text{C}$. તાપમાને ૪ મહિના સુધી સંગ્રહી શકાય છે.

- પ્રાધ્યાપક અને વડા, તેરી કેમેસ્ટ્રી વિભાગ, તેરી વિજ્ઞાન મહાવિદ્યાલય,
આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૬૨) ૨૬૪૧૭૦
ઈ-મેઈલ : principaldsc@aau.in

૧૨.૧૦ સ્ટાન્ડર્ડ દૂધમાં સરગવાની સિંગનો પાઉડર ઉમેરી લસ્સી બનાવવાની પદ્ધતિ

આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા સ્ટાન્ડર્ડ દૂધમાં સરગવાની સિંગનાં પાઉડરને ૧.૬૩ % પ્રમાણે ઘટક તરીકે ઉમેરીને લસ્સી બનાવવામાં આવેલ છે. આ લસ્સી વિટામિન એ, વિટામિન સી, કેલ્ખિયમ, લોહ તત્ત્વ, પોટેશિયમ અને રેસા ધરાવે છે. આ લસ્સીને રેફીજરેટર તાપમાને ($7\pm 2^{\circ}\text{C}$) જવાણું વિહીન કરેલી પેટ (PET) બોટલમાં ૩૦ દિવસ સુધી સંગ્રહી શકાય છે.

- પ્રાધ્યાપક અને વડા, ડેરી માઈક્રોબાયોલોજી વિભાગ, ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલય, આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૮૨) ૨૬૧૦૩૦
ઈ-મેઈલ : principaldsc@aau.in

૧૨.૧૧ ઈન કન્ટેનર સ્ટરિલાઇઝડ દૂધપાકના વ્યાપારી ઉત્પાદન માટેની પદ્ધતિ

ડેરી ઉદ્યોગ અને ઉદ્યોગસાહસ્રિકોને, ઈન-કન્ટેનર સ્ટરિલાઇઝડ (૧૨૧૦સે. / મિનિટ) દૂધપાકના ઉત્પાદન માટે, આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલ પદ્ધતિ અપનાવવાની ભલામણ કરવામાં આવે છે. આ દૂધપાક, સ્ટાન્ડર્ડાઇઝડ દૂધને (૪.૫ ફેટ અને ૮.૫ % એસ. એન. એફ.) , સ્કેપ્ટસરફેસ હીટ એક્સ્ટ્રેંજર (એસ.એસ.એચ.ઈ.) દ્વારા ૧.૬ ગણું ઘણું કરીને તેમાં સુગંઘિત ચોખા અને ખાંડ અનુક્રમે @ ૨.૨ % અને ૧૧ % ઘણું દૂધના પ્રમાણમાં ઉમેરીને બનાવેલ છે. આ દૂધપાક સામાન્ય તાપમાને ($7\pm 2^{\circ}\text{C}$) ૭૫ દિવસ અને રેફીજરેટેડ તાપમાને ($5\pm 2^{\circ}\text{C}$) ૧૦૫ સુધી સારો રાખી શકાય છે.

- પ્રાધ્યાપક અને વડા, ડેરી ઈજનેરી વિભાગ, ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલય, આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૮૨) ૨૨૫૮૭૩
ઈ-મેઈલ : principaldsc@aau.in

૧૨.૧૨ લાંબી સંગ્રહક્ષમતા ધરાવતી બાસુંદી બનાવવાની પદ્ધતિ

આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા લાંબી સંગ્રહક્ષમતા ધરાવતી બાસુંદી બનાવવાની પદ્ધતિ વિકસાવેલ છે. આ પ્રક્રિયામાં શૂન્યવકાશમાં (૬૦ એમ. એમ. HG.) બાસુંદીને ઘણું કરી બોટલમાં ભરીને રોટરી સ્ટરીલાઈઝરમાં ૧૧૦°સે. તાપમાને ૧૫ મિનિટ સુધી ગરમ કરવામાં આવે છે. ઉપરોક્ત પ્રક્રિયાથી બનાવેલ બાસુંદી ત૭ \pm ૨°સે. તાપમાને ૮૦ દિવસ સુધી સંગ્રહી શકાય છે.

- પ્રાધ્યાપક અને વડા, ડેરી ઈજનેરી વિભાગ, ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલય,
આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૬૨) ૨૨૫૮૭૩
ઈ-મેઈલ : principaldsc@aau.in

(૧૩) ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી

૧૩.૧ ફળ-શાકભાજુનું નુકસાન ઘટાડવા માટે સૂર્ય-શક્તિથી સંચાલિત ઈકો-ફેન્ડલી હાથલારીનો ઉપયોગ

ફળ અને શાકભાજુના છૂટક વેપારીઓને આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલ ‘સૂર્યશક્તિથી સંચાલિત ઈકો-ફેન્ડલી હાથલારી’ નો ઉપયોગ કરવા ભલામણ છે. આ હાથલારીમાં (ઉનાળાના મહિનાઓ દરમિયાન સંગ્રહપેટી (૧૪.૧૨ ઘનફૂટ) ની અંદરનું તાપમાન ૨૨ \pm ૨.૮૬°સે. અને ભેજ ૮૨ \pm ૩.૨૮% જળવાઈ રહે છે જેથી ફળ અને શાકભાજુને લાંબો સમય સાચવી. તાજા રાખીને છૂટક વેચાણના ધોરણે નુકસાન ઘટાડવામાં મદદરૂપ થાય છે.



- પ્રાધ્યાપક અને વડા, પીએચેઈટી વિભાગ, એફ્પીટીબીઈ મહાવિદ્યાલય,
આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૬૨) ૨૬૧૩૦૨
ઈ-મેઈલ : deanfpt@aau.in

૧૩.૨ કેરી વ્હે આધારિત શક્કરટેટી અને લીંબુના રસનો ઉપયોગ કરીને તૈયાર પીણા બનાવવાની તાંત્રિકતા

તેરી વ્હે આધારિત, શક્કરટેટી અને લીંબુના રસનો ઉપયોગ કરીને બનાવેલ તૈયાર પીણાનાં ઉત્પાદનમાં રસ ધરાવતા ઉદ્યોગકારો/ સાહસિકોને આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલ પ્રોસેસિંગ તાંત્રિકતાનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. આ તાંત્રિકતામાં પીણું બનાવવા માટેની ફોર્મ્યુલેશનમાં



સમાવેશ કરવામાં આવેલા તત્વો (તેરી વ્હે ૫૧.૩૫ મિલિ, શક્કરટેટીનો જ્યૂસ ૪૦ મિ.લિ. અને લીંબુનો રસ ૬.૧૮ મિ.લિ.) અને થર્મલ પ્રોસેસિંગનો (૨૦૦ મિલિગ્રામ ગ્લાસ બોટલમાં ૮૫%સે તાપમાને પીણાને હોટ ફિલિંગ કરી સીલ કરી ૮૫%સે. તાપમાનવાળા પાણીમાં ૧૫ મિનિટ માટે પ્રોસેસિંગ કરવાનું) સમાવેશ થાય છે. આ રીતે તૈયાર થતા પીણાને ત્રાશ મહિના સુધી સામાન્ય તાપમાને સંગ્રહી શકાય છે.

- પ્રાધ્યાપક અને વડા, પીએચઈટી વિભાગ, એફ્પીટીબીઈ મહાવિદ્યાલય,
આકૃયુ, આણંદ ફોન : (૦૨૬૮૨) ૨૬૧૩૦૨ • ઈ-મેઈલ : deanfpt@aau.in

૧૩.૩ ઈલાયચીના પાઉડરના ઉત્પાદન માટે કાયોજેનિક ગ્રાઇન્ડિંગની તાંત્રિકતા

ઈલાયચીના પાઉડરનું ઉત્પાદન કરતા ઉદ્યોગસાહસિકો તથા ઉદ્યોગકારોને ઉત્તમ ગુણવત્તાવાળા પાઉડરનું ઉત્પાદન કરવા માટે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલ કાયોજેનિક ગ્રાઇન્ડિંગની તાંત્રિકતા વાપરવાની ભલામણ કરવામાં આવે છે. આ તાંત્રિકતાથી બનાવેલ ઈલાઈચી પાઉડરમાં સાઢી દળવાની પદ્ધતિની સાપેક્ષે, ઊંચી



ગુણવત્તા સહિત, બાધ્યકારી તૈલીય પદાર્થ વધુ પ્રમાણમાં જળવાઈ રહે છે. આ માટે જરૂરી તાપમાન -૪૦°Cને, વહનક્ષમતા ૭ કિ.ગ્રા. પ્રતિ કલાક અને ૧.૫ મિ.મી. ના છીડ્ર ધરાવતી જાળીનો ઉપયોગ કરવાનો રહે છે.

- પ્રાધ્યાપક અને વડા, પીએચેઈટી વિભાગ, એફ્પીટીબીઈ મહાવિદ્યાલય,
આંકૃત્ય, આણંદ-૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૮૨) ૨૬૧૩૦૨ • ઈ-મેઈલ : deanfpt@aau.in

૧૩.૪ સરગવાના પાનની ગુણવત્તાયુક્ત સૂક્વણીની તાંત્રિકતા

સરગવાના પાનની ગુણવત્તાયુક્ત સૂક્વણી કરવા ઈચ્છતા ઉદ્ઘોગસાહસિકો અને કૂડ પ્રોસેસરોને આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલ સૂક્વણીની તાંત્રિકતાનો ઉપયોગ કરવા ભલામણ કરવામાં આવે છે. આ તાંત્રિકતા મુજબ વેક્યુમ ડ્રાયરમાં ૪૫%ને તાપમાને ૩.૫ કલાક સુધી ૪૫૦ મીમી મરક્કુરી દબાડો શૂન્યાવકાશમાં સૂક્વેલાં સરગવાના પ્રતિ ૧૦૦ ગ્રામ પાનમાં બીટા-કેરોટીન અને વિટામિન સી અનુક્રમે ૨૬.૮૮ મિ.ગ્રા. (૮૩.૬ %) અને ૧૮૬.૬૩ મિ.ગ્રા. (૨૨ %) સચવાયેલા જોવા મળે છે.



- પ્રાધ્યાપક અને વડા, પીએચેઈટી વિભાગ, એફ્પીટીબીઈ મહાવિદ્યાલય,
આંકૃત્ય, આણંદ-૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૮૨) ૨૬૧૩૦૨ • ઈ-મેઈલ : deanfpt@aau.in

૧૩.૫ ઓસ્મોટિક પ્રક્રિયાથી નિર્જળીકરણ કરેલ આમળાની કેંઠીના ઉત્પાદનમાં ઉત્પાદનની તાંત્રિકતા

ઓસ્મોટિક પ્રક્રિયાથી નિર્જળીકરણ કરેલ આમળાની કેંઠીના ઉત્પાદનમાં રસ ધરાવતા ઉદ્ઘોગસાહસિકો અને ફળફળાદીના પ્રોસેસરોને આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલ ટેકનોલોજીનો ઉપયોગ કરવા ભલામણ કરવામાં

આવે છે. આ તાંત્રિકતા દ્વારા ખાંડની ચાસણી (૫૦° બ્રિક્સમાં) માયકોવેવ વેક્યુમની મદદથી આમળાના ચીરીયાનું ઓસ્મોટિક પ્રક્રિયાથી નિર્જળીકરણ કર્યા બાદમાં ઈકોવેવ વેક્યુમથી સૂક્વણી



કરવામાં આવે છે. આ પ્રક્રિયાના પરિણામે કાચા આમળામાં રહેલ ૮૦% થી વધુ એસ્કોર્બિક એસિડને જાળવી રાખવા સહિત સારી ગુણવત્તાવાળી મીઠાશ ધરાવતી નિર્જળીત આમળાની કેન્દી મેળવી શકાય છે.

- પ્રાધ્યાપક અને વડા, ફૂડ એન્જિનીયરિંગ વિભાગ, એફ્પીટીબીઈ મહાવિદ્યાલય, આંકૃત્ય, આણંદ-૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૮૨) ૨૬૧૩૦૨ • ઈ-મેઈલ : deanfpt@aau.in

૧૩.૬ કાજુકતરીના ઉત્પાદન માટે ફૂકિંગ અને ફૂલિંગ સિસ્ટમ ધરાવતા મશીનનો ઉપયોગ



કાજુકતરીના બહોળા ઉત્પાદનમાં રસ ધરાવતા ઉદ્યોગસાહસિકોને આણંદ ફૂલિંગ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલ ફૂકિંગ અને ફૂલિંગ સિસ્ટમ ધરાવતા મશીનનો ઉપયોગ કરવા ભલામણ કરવામાં આવે છે. આ ફૂકિંગ અને ફૂલિંગ પ ડિ.ગ્રા./ચો. સે.મી. વરાળનું દબાણ હું આર.પી.એમ. સેપરની ઝડપથી ચલાવવાથી ૧૦

કિ.ગ્રા./કલાક કાજુ કટરી બનાવી શકાય છે. એસ.એસ.એચ.ઈ.માં કાજુ કટરી બનાવતી વખતે ૧ કિ.ગ્રા. પાણી બાઘીભૂત કરવા ૧.૫ર કિ.ગ્રા. જેટલી વરાળ વપરાય છે. જ્યારે ૧ કિ.ગ્રા. કાજુકટરી બનાવવા માટે ૦.૧૪ કિલોવોટ વીજળીનો વપરાશ થાય છે. આ મશીનની અંદાજીત કિંમત કાજુકટરી બનાવવા માટે ૦.૧૪ કિલોવોટ વપરાય છે. આ મશીનની અંદાજીત કિંમત ₹ ૭૬,૧૨૫ થાય છે અને આ પદ્ધતિ મુજબ કાજુકટરી બનાવવાનો ખર્ચ ₹ ૮.૨૧/કિ.ગ્રા. આવે છે.

- ગ્રાધ્યાપક અને વડા, ફૂડ ઓન્જિનીયરિંગ વિભાગ, એફ્પીટીબીઈ મહાવિદ્યાલય, આંકૃત્ય, આણંદ-૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૯૨) ૨૬૧૩૦૨ • ઈ-મેઈલ : deanfpt@aau.in

૧૩.૭ કાજુકટરીના ઉત્પાદન માટે વિકસાવેલ રોલિંગ, શીટિંગ અને કટિંગનો મશીન



કાજુકટરીના ઉત્પાદનમાં રસ ધરાવતા ઉદ્યોગસાસહિકોને આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ દ્વારા વિકસાવેલ રોલિંગ, શીટિંગ અને કટિંગનો ઉપયોગ કરવા ભલામણ કરવામાં આવે છે. આ મશીનથી ડાયમંડ આકાર (૩૦ મિ.મી. x ૩૦ મિ.મી. x ૫ મિ.મી.) ની કાજુકટરીને રોલિંગ,

શીટિંગ અને કટિંગ કરી શકાય છે. આ મશીનની અંદાજીત કિંમત ₹ ૧,૧૦,૧૦૦/- થાય છે. જ્યારે પ્રક્રિયાની કિંમત ₹ ૫.૪૬ પ્રતિ કિ.ગ્રા. થાય છે.

- ગ્રાધ્યાપક અને વડા, ફૂડ ઓન્જિનીયરિંગ વિભાગ, એફ્પીટીબીઈ મહાવિદ્યાલય, આંકૃત્ય, આણંદ-૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૯૨) ૨૬૧૩૦૨ • ઈ-મેઈલ : deanfpt@aau.in

૧૩.૮ કોઠામાંથી જ્યુસ બનાવવા માટેની પદ્ધતિ



કોઠામાંથી જ્યુસ બનાવવામાં રસ ધરાવતા ઉદ્યોગસાહસિકને આણંદ કુષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલ ટેકનોલોજી ઉપયોગ કરવા માટે ભલામણ કરવામાં આવે છે. આ ટેકનોલોજી મુજબ કોઠાના ગરને વરાળથી ૬ મિનિટ સુધી બાફ્ફનું અને ઉત્સેચક (પેક્ટીનેસ : સેલ્વુલેઝ (૭:૩) મિશ્રણ, ૩૦ ગ્રામ/૧૦૦ ગ્રામ પલ્યના દરે ૬ કલાક માટે ૪૦°સે.) દ્વારા પ્રાથમિક પ્રક્રિયા આપીને જ્યુસ એક્સટ્રેક્ટર વડે રસ કાઢવામાં આવે છે. જેથી રસ અને તેમાં રહેલ દ્રાવ્ય ઘનપદાર્થ મહત્તમ પ્રમાણમાં મળી રહે. ૮૦°સે. ૮ મિનિટ સુધી ગરમ કરેલ કોઠાનું આ જ્યુસ સામાન્ય તાપમાને (૩૭°સે.) ૫ મહિના સુધી જીવાણુમુક્ત રાખી શકાય છે.

- પ્રાધ્યાપક અને વડા, ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી વિભાગ, એફ્પીટીબીઈ મહાવિદ્યાલય, આકૃષુ, આણંદ-૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૬૨) ૨૬૧ ૩૦૨
ઈ-મેઈલ : deanfpt@aau.in

૧૩.૯ કોઠાના પાઉડરનો ખાદ્ય બનાવવામાં ઉપયોગ

આઈસ્કીમ અને લોફેટ સ્પેઝ બનાવનાર ઉદ્યોગસાહસિકો કેરોટીનોઇડ ફોર્ટિફાઇડ આઈસ્કીમ અને લો ફેટ સ્પેઝ ઉત્પાદન કરવા માટે આણંદ કુષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલ તાંત્રિકતાના ઉપયોગની ભલામણ કરવામાં આવે છે.



- (૧) કેરોટીનોઈડ ફોર્ટિફાઈડ આઈસ્કીમ ઉત્પાદન કરવા માટે આ ટેકનોલોજીમાં શૂન્યાવકાશમાં સૂકૃવણી કરેલ કોળાના પાઉડરમાંથી સુપર કિટિકલ દ્રાવક નિષ્કર્ષણ કરી, ઉત્પાદિત કરેલ કેરોટીનોઈડ ૪૫૦ મિ.ગ્રા/૧૦૦ ગ્રામ આઈસ્કીમ મિક્સમાં ઉમેરીને આઈસ્કીમ બનાવી શકાય. આ રીતે ઉત્પાદન કરેલ આઈસ્કીમમાં બીટા કેરોટીન ૮૩.૨૨ મિ.ગ્રા/૧૦૦ ગ્રામ મળે છે.
- (૨) કેરોટીનોઈડ ફોર્ટિફાઈડ લોફેટ સ્પ્રેડ ઉત્પાદન કરવા માટે આ તાંત્રિકતામાં શૂન્યાવકાશમાં સૂકૃવણી કરેલ કોળાના પાઉડરમાંથી સુપર કિટિકલ દ્રાવક નિષ્કર્ષણ કરી, ઉત્પાદિત કરેલ કેરોટીનોઈડ ૧૫૦ મિ.ગ્રા/૧૦૦ ગ્રામ સ્પ્રેડમાં ઉમેરીને લો ફેટ સ્પ્રેડ બનાવી શકાય. આ રીતે ઉત્પાદન કરેલ લો ફેટ સ્પ્રેડમાં કેરોટિન ૩૫.૨૬ મિ.ગ્રા/૧૦૦ ગ્રામ મળી રહે છે.

- પ્રાધ્યાપક અને વડા, ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી વિભાગ, એફ્પીટીબીઈ મહાવિદ્યાલય, આકૃષુ, આણંદ-૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૮૨) ૨૬૧૩૦૨
ઈ-મેઈલ : deanfpt@aau.in

૧૩.૧૦ ઈડલીના ખીરાને સાચવવા માટે વિકસાવવામાં આવેલ તાંત્રિકતા

ઇડલીના ખીરાને સાચવવા ઈચ્છા ઉદ્ઘોગસાહસ્રિકોને આણંદ કૃષી યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલ તાંત્રિકતાનો ઉપયોગ કરવા ભલામણ કરવામાં આવે છે. ખાસ પ્રકારના મેળવણ વડે નિયંત્રિત આથવણથી બનાવેલ ઈડલીના ખીરાને ૬૦ μm પોલીલેભિનેટેડ પાઉચમાં નાઈટ્રોજન ગેસની સાથે પેક કરી $7 \pm 2^\circ$ સે. તાપમાને રાખવાથી ૮ દિવસ સુધી સાચવી શકાય છે.

પસંદ કરેલા સૂક્ષ્મજીવાશુઓ વડે નિયંત્રિત આથવણથી ઈડલીના ખીરાને ૧૦૦ μm કંપન વિસ્તારની સોનીકેશન પ્રક્રિયા ૧૫ મિનિટ સુધી આપી, તેને ૬૦ μm



પોલીલેમિનેટેડ પાઉચમાં નાઈટ્રોજન ગેસની સાથે પેક કરી $7\pm2^{\circ}$ સે તાપમાને રાખવાથી ૧૫ દિવસ સુધી સાચવી શકાય છે.

- પ્રાધ્યાપક અને વડા, એફક્યુએ વિભાગ, એફ્પીટીબીઈ મહાવિદ્યાલય,
આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૮૨) ૨૬૧૩૦૨
ઈ-મેઈલ : deanfpt@aau.in

૧૩.૧૧ બટાટાના પ્રોસેસિંગ દરમિયાન ઉત્પાદિત થતા બાય-પ્રોડક્ટમાંથી ઈથેનોલ બનાવવાની તાંત્રિકતા

બટાટાના પ્રોસેસિંગ દરમિયાન ઉત્પાદિત થતા બાય-પ્રોડક્ટમાંથી ઈથેનોલ બનાવવામાં રસ ધરાવતા ઉદ્યોગસાહસિકોને આણંદ કૂષિ યુનિવર્સિટી દ્વારા વિકસિત એમાયલોલાઈટિક *Sacharomyces cerevisiae* ETGSI કલ્યર અને પ્રક્રિયાનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. આ તાંત્રિકતા દ્વારા ઓછા ઈનપુટ સાથે બટાટા પ્રોસેસિંગના પ્રવાહી અને જીલેટીનાઈઝ બટાટાના વેસ્ટના બાયોપ્રોસેસિંગથી ૦.૪૫ ગ્રામ પ્રોડક્ટ / ગ્રામ સબસ્ટ્રેટની ઉપર અને ૮૮.૫૩ % આથવાણી પ્રક્રિયાની કાર્યક્ષમતાથી ઈથેનોલનું ઉત્પાદન કરવા સક્ષમ છે.

- પ્રાધ્યાપક અને વડા, એફક્યુએ વિભાગ, એફ્પીટીબીઈ મહાવિદ્યાલય,
આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૮૨) ૨૬૧૩૦૨
ઈ-મેઈલ : deanfpt@aau.in

૧૩.૧૨ બાયોગેસ ખાનટની ડાયજેસ્ટેડ સ્લરીમાંથી બાયોમેન્થ્યુર ગેન્યુઅલ્સ બનાવવાની તાંત્રિકતા

નાની ક્ષમતાવાળા બાયોગેસ ખાનટ ધરાવતા લોકોને આણંદ કૂષિ યુનિવર્સિટી, આણંદ દ્વારા વિકસાવેલ કંતાણબોરા તથા સ્ટેન્ડમાં ઉપયોગથી બાયોગેસ ડાયજેસ્ટેડ સ્લરીમાંથી પાણી



અને ગહુ છૂટો પાડવાની તકનીકનું પ્રયોગ, એમના સારા નિકાલ માટે કરવાની ભલામણ છે. ભેજ શોખી શકે એવી વસ્તુઓ જેવી કે મરઘાનું સૂકુ હગાર (૨૦ %), લાકડાની રાખ (૧૦ %) અને ગહુ (૭૦ %) સાથે મિશ્રણ કરીને બોયોમેન્યુર ગ્રેન્યુલ્સ બનાવી સંગ્રહ કરી શકાય છે.

- પ્રાધ્યાપક અને વડા, બાયોએનજી વિભાગ, એફ્પીટીબીઈ મહાવિદ્યાલય,
આકૃષુ, આણંદ-૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૬૨) ૨૬૧૩૦૨
ઈ-મેઈલ : deanfpt@aau.in

૧૩.૧૩ હાઈ ફાઇબર ફ્લેડ અને બિસ્કીટના ઉત્પાદનમાં આમળા / ગાજરના રસ કાઢ્યા બાદ રહી ગયેલ માવાના પાઉડરના ઉપયોગની તાંત્રિકતા



- (૧) આમળાનો રસ કાઢ્યા બાદ રહી ગયેલા માવાનો પાઉડર ૨૫ ટકાના દરે ઉમેરી સંતોષકારક હાઈ ફાઇબર બ્રેડનું ઉત્પાદન કરવા બેકરી વાનગીઓના ઉત્પાદકો અને ઉદ્યોગસાહસિકોને આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવાયેલ ટેકનોલોજીનો ઉપયોગ કરવા ભલામણ કરવામાં આવે છે.
- (૨) આમળામો રસ કાઢ્યા બાદ રહી ગયેલા માવાનો પાઉડર ૧૨ ટકાના દરે ઉમેરી સંતોષકારક હાઈ ફાઇબર બિસ્કીટનું ઉત્પાદન કરવા બેકરી વાનગીઓના ઉત્પાદકો અને ઉદ્યોગસાહસિકોને આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવાયેલ ટેકનોલોજીનો ઉપયોગ કરવા ભલામણ કરવામાં આવે છે. આવા હાઈ ફાઇબર બિસ્કીટ સામાન્ય વિકસાવાયેલ એલ્યુમિનિયમ ફોઈલમાં ૨ મહિના સુધી સંગ્રહી શકાય છે.
- (૩) ગાજરનો રસ કાઢ્યા બાદ રહી ગયેલા માવાનો પાઉડર ૪ ટકાના દરે ઉમેરી

સંતોષકારક હાઈ ફાયબર બ્રેડનું ઉત્પાદન કરવા બેકરી વાનગીઓના ઉત્પાદકો અને ઉદ્યોગસાહસિકોને આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવાયેલ ટેકનોલોજીનો ઉપયોગ કરવા ભલામણ કરવામાં આવે છે.

- (૪) ગાજરનો રસ કાઢવા બાદ કરી ગયેલા માવાનો પાઉડર ૨૦ ટકાના દરે ઉમેરી સંતોષકારક હાઈ ફાયબર બિસ્કીટનું ઉત્પાદન કરવા બેકરી વાનગીઓના ઉત્પાદકો અને ઉદ્યોગસાહસિકો આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવાયેલ ટેકનોલોજીનો ઉપયોગ કરવા ભલામણ કરવામાં આવે છે. આવા હાઈફાયબર બિસ્કીટ સામાન્ય વાતાવરણમાં પ્લાસ્ટિક કન્ટેઇનર તેમજ એલ્યુમિનિયમ ફોઇલમાં અઢી મહિના સુધી સંગ્રહી શકાય છે.

- પ્રાધ્યાપક અને વડા, બાગાયત વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય,
આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૮૨) ૨૮૦૨૫૦
ઈ-મેઈલ : shahnitin1968@aau.in

૧૩.૧૪ સીતાફળના સંગ્રહની પદ્ધતિ

ગુજરાતના આદિવાસી વિસ્તારના ખેડૂતો માટે ભલામણ કરવામાં આવે છે કે પાકેલાં સીતાફળને ૧૦૦ ગેજ પોલીપ્રોપીલિન બેગ (૧૫.૨૪ મિ.મી. X ૨૦.૩૨ મિ.મી.) દીઠ ત્રણ ફળ ભરીને ૧૩° સે. તાપમાને સંગ્રહ કરવામાં આવે તો તેને ૮ થી ૧૦ દિવસ સુધી વધુ સારી ગુણવત્તા સાથે સાચવી શકાય છે અને સંગ્રહ દરમ્યાન તેના વજનમાં ઓછો ઘટાડો અને વિટામિન સીનું પ્રમાણ વધારે જળવાઈ રહે છે.



- આચાર્ય, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય, આકૃયુ,
ગોધરા-૩૮૮૦૦૧ ફોન : (૦૨૬૭૨) ૨૬૫૧૨૮
ઈ-મેઈલ : dean.caet@aau.in

(૧૪) કૃષિ ઈજનેરી

૧૪.૧ બળદ સંચાલિત હળ વડે ચલાવી શકાય તેવું બહુલક્ષી પાકો માટેનું પ્લાન્ટિંગ યુનિટ



ખેડૂતોને આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસિત બળદ સંચાલિત હળ વડે ચલાવી શકાય તેવું ઓછી ડિમ્યુન્ટનું બહુલક્ષી પાકો માટેનું પ્લાન્ટિંગ યુનિટ મકાઈ, તુવેર, સોયાબીન અને ચણાના પાકનું વાવેતર કરવા માટે ભલામણ કરવામાં આવે છે. આ યુનિટની મદદથી મકાઈનું વાવેતર કરવાથી દાણા થાણીને વાવવાની પદ્ધતિ કરતાં આશરે ૮૪ ટકા સમય તેમજ આશરે ૭૫ ટકા ખર્ચમાં બચત

થાય છે તેમજ હળ સાથે ઓરાઇની જોડીને મકાઈના દાણા ઓરવાની પદ્ધતિ કરતાં ૫૭ ટકા બિયારણમાં બચત થાય છે.

- આચાર્ય, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય, આંકૃત્ય,
ગોધરા-૩૮૬૦૦૧ ફોન : (૦૨૬૭૨) ૨૬૫૧૨૮ ઈ-મેઈલ : dean.caet@aau.in

૧૪.૨ માનવ સંચાલિત બે પૈડાવાળી કરબડી

આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા જરૂરિયાત મુજબ ગોઠવી શકાય તેવી માનવ સંચાલિત બે પૈડાવાળી કરબડી વિકસાવવામાં આવેલ છે. જે બે હાર વચ્ચેથી નીંદણ દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી માલૂમ પડેલ છે. તેની



કાર્યક્ષમતા ૦.૦૮૩ હેક્ટર પ્રતિ કલાક, કાર્યક્ષમતા ૮૭.૮૧% તેમજ નીંદણ દૂર કરવાની ક્ષમતા ૭૮.૮% કરતાં વધારે છે. તેની અંદાજે કિમત ₹ ૧૫૦૦ જેટલી થાય છે.

- આચાર્ય, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય, આકૃષુ, ગોધરા-૩૮૮૦૦૧ ફોન: (૦૨૬૭૨) ૨૬૫૧૨૮ • ઈ-મેઈલ: dean.caet@aau.in

૧૪.૩ તુવેરમાંથી શીંગો છૂટી પાડવા માટે વિકસાવવામાં આવેલ ડાંગર થ્રેસર

તુવેર પક્કવતા ખેડૂતો માટે ભલામણ કરવામાં આવે છે કે તુવેરમાંથી શીંગો છૂટી પાડવા માટે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલ વિદ્યુતથી ચાલતા ડાંગર થ્રેસરનો ઉપયોગ કરી શકાય. આ થ્રેસરનાં ઉપયોગથી શીંગો સરળતાથી છૂટી પાડી શકાય છે. આ થ્રેસરથી શીંગો છૂટી પાડવાની ક્ષમતા આશરે ૧૮૩.૩૨ કિ.ગ્રા./કલાક છે જે માણસો દ્વારા ઝૂડવાની/ધોકાવવાથી ૩.૬૨ ગણી વધારે છે. થ્રેસરની કાર્યક્ષમતા ૮૪.૪૪ ટકા છે.

- આચાર્ય, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય, આકૃષુ, ગોધરા-૩૮૮૦૦૧ ફોન: (૦૨૬૭૨) ૨૬૫૧૨૮ • ઈ-મેઈલ: dean.caet@aau.in

૧૪.૪ સિંગલ સીલિન્ડર મીની ફાર્મ ટ્રેક્ટર સીટના વાઈબ્રેશન ઘટાડવા માટે પેડનો ઉપયોગ

મીની ટ્રેક્ટર સાથે સંકળાયેલ હિતધારકોન સિંગલ સીલિન્ડર મીની ફાર્મ ટ્રેક્ટરની સીટના વાઈબ્રેશન ઘટાડવા માટે સીટની નીચે વાઈબ્રેશન આઈસોલેશન પેડ અને રબરશીટનું કમ્બાઇન્ડ પેડ બેસાડવા ભલામણ કરવામાં આવે છે. વધુમાં એન્જિન ઓપરેશનથી



(ઉત્પન્ન થતા વર્ટિકલ (ઓફા) વાઈબ્રેશન ઘટાડવા માટે કોક્ફેડનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે.

- આચાર્ય, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય, આકૃયુ, ગોધરા-૩૮૮૦૦૧ ફોન: (૦૨૬૭૨) ૨૬૫૧૨૮ • ઈ-મેઈલ: dean.caet@aau.in

૧૪.૫ આદુ અને હળદરની સૂક્વણી માટે બાયોમાસ કમ્બસ્ટર આધારિત ડ્રાયરનો ઉપયોગ

એગ્રો પ્રોસેસર્સ અને ઉદ્યોગસાહસિકોને આદુ અને હળદર સૂક્વણવા આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલ ૧૦૦ કિલો સૂક્વણીની ક્ષમતા ધરાવતા બાયોમાસ કમ્બસ્ટર આધારિત ડ્રાયરનો ઉપયોગ કરવા ભલામણ કરવામાં આવે છે. આ ડ્રાયરને સૂક્વણી યંત્રમાં ૪૦૦ ઘનમીટર પ્રતિ કલાક હવાના પ્રવાહ દરનો ઉપયોગ કરી આદુ અને હળદરની સૂક્વણી કરવા માટે એક કિ.ગ્રા. પ્રતિ કલાક લાકડાના વેરની બ્રિકેટસના વપરાશથી મહત્તમ કમ્બસ્ટર કાર્યદક્ષતા (૭૩.૫૦ %) મળે છે. લાકડાના વેરની બ્રિકેટસનો બળતણ તરીકે ઉપયોગ કરતાં ૪૭-૪૮% તાપમાનવાળી ઉત્પન્ન થતી ગરમ હવાથી ૨૭૬ મિનિટ (આદુ માટે પ્રારંભિક ૮૧.૪૧ થી ૮ % અંતિમ ભેજ લાવવા) અને ૮૦૭ મિનિટ (હળદર માટે પ્રારંભિક ૮૪.૬૦ થી ૮ % ભેજ લાવવા) જેટલો સૂક્વણી સમય લાગે છે.



- આચાર્ય, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય, આકૃયુ, ગોધરા-૩૮૮૦૦૧ ફોન: (૦૨૬૭૨) ૨૬૫૧૨૮ • ઈ-મેઈલ: dean.caet@aau.in

(૧૫) પશુ પોષણ

૧૫.૧ ઉછરતાં સંકર વાઇરડા/વાઇરડીઓ માટે કુલ ભિશ્રિત પશુઆહાર

પશુપાલકોને ભલામણ કરવામાં આવે છે કે ઉછરતાં સંકર વાઇરડા/વાઇરડીઓને ૫૦ % ખાણદાણ, ૨૫ % ઘઉંનું કુવળ અને ૨૫ % ભગફળી ગોતર લઈને બનાવેલ કુલ ભિશ્રિત પશુ આહાર ખવડાવવાથી ૫૦ % ખાણદાણ અને ૫૦ % ઘઉં કુવળ લઈને બનાવેલ કુલ ભિશ્રિત પશુ આહાર કરતા વૃદ્ધિરમાં ૨૦ % નો વધારો અને દૈનિક મીથેન વાયુના ઉત્સર્જનમાં ૧૩ %નો ઘટાડો થાય છે.

- સંશોધન વૈજ્ઞાનિક અને વડા, પશુપોષણ સંશોધન કેન્દ્ર, આકૃયુ, આંધ્ર-૨૮૮૧૧૦ ફોન : (૦૨૬૬૨) ૨૬૩૪૪૦
ઈ-મેઈલ : pareshpandya@aau.in

૧૫.૨ છોટાઉદેપુર જીવાની ઓછું દૂધ આપતી ગાયોની પોષક તત્વોની જરૂરિયાત

છોટાઉદેપુર જીવાના પશુપાલકોને ભલામણ કરવામાં આવે છે કે દૈનિક ૧૦ કિ.ગ્રા. થી ઓછું દૂધ આપતી ગાયોની પોષક તત્વોની જરૂરિયાત પૂર્ણ કરવા હાલમાં અપાતા દાણ કરતા ૧ કિ.ગ્રા. તથા ૧૧-૧૪ કિ.ગ્રા. દૂધ આપતી ગાયોને ૧.૫ કિ.ગ્રા. જેટલું વધારાનું દાણ ઉનાળા તથા શિયાળામાં આપવું જયારે ચોમાસામાં ૦.૫ કિ.ગ્રા. જેટલું વધારાનું દાણ આપવું જોઈએ.



- સંશોધન વૈજ્ઞાનિક અને વડા, પશુપોષણ સંશોધન કેન્દ્ર, આકૃયુ, આંધ્ર-૨૮૮૧૧૦ ફોન : (૦૨૬૬૨) ૨૬૩૪૪૦
ઈ-મેઈલ : pareshpandya@aau.in

૧૫.૩ છોટાઉદેપુર જુલ્લાની ઓછું દૂધ આપતી ભેંસોની પોષક તત્વોની જરૂરિયાત

છોટાઉદેપુર જુલ્લાના પશુપાલકોને દૈનિક ૧૦ કિ.ગ્રા. થી ઓછું દૂધ આપતી ભેંસોની પોષક તત્વોની જરૂરિયાત પૂર્ણ કરવા તેમના દ્વારા હાલ અપાતા દાણ કરતાં, ઉનાળામાં વધારાનું દૈનિક ૧.૫

કિ.ગ્રા. અને ચોમાસા તથા શિયાળામાં ૧ કિ.ગ્રા. સુભિંશ્રિત દાણ આપવાની ભલામણ કરવામાં આવે છે.



- સંશોધન વૈજ્ઞાનિક અને વડા, પશુપોષણ સંશોધન કેન્દ્ર, આંકૃત્યુ, આંધ્રા -૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૬૨) ૨૬૭૪૪૦
ઈ-મેઈલ : pareshpandya@aau.in

૧૫.૪ બોટાદ જુલ્લા માટે વિસ્તાર અનુશ્ય ક્ષાર મિશ્રણની બનાવટ



બોટાદ જુલ્લાના પશુપાલકો માટે ભલામણ કરવામાં આવે છે કે, જુલ્લામાં ક્ષારોની ઉણાય ધ્યાને રાખીને કોઈમાં જીણાબ્યા મુજબના સ્પષ્ટિકરણ કરેલા ક્ષાર મિશ્રણને પુખ્ખ વયના પશુ દીઠ દરરોજ ૩૦ ગ્રામ ખવડાવવાની ભલામણ કરવામાં આવે છે.

ક્રમ	ક્ષાર તત્વ	જરૂરિયાત (રૂકા)
૧	કેલ્થિયમ	૨૦.૦૦
૨	ફોસ્ફરસ	૧૨.૦૦
૩	મેનેન્શિયમ	૦૫.૦૦
૪	ગંધક (સલ્ફર)	૦૧.૮૦
૫	તાંબુ (કોપર)	૦૦.૧૦
૬	જસ્ત (ટિંક)	૦૧.૭૮
૭	મેંગેનીઝ	૦૦.૧૨
૮	લોહ (આયની)	૦૦.૪૦
૯	કોબાલ્ટ	૦.૦૧૨
૧૦	આયોડિન	૦.૦૨૬

- સંશોધન વૈજ્ઞાનિક અને વડા, પશુપોષણ સંશોધન કેન્દ્ર, આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૬૨) ૨૬૩૪૪૦
ઈ-મેઈલ : pareshpandya@aau.in

૧૫.૫ દૂધાળ સુરતી બકરીઓ માટે કુલ મિશ્રિત આહારમાં જીવંતી/ડોડી અને બાયપાસ ફેટનો ઉપયોગ



બકરાં પાલકોને ભલામણ કરવામાં આવે છે કે દૂધાળ સુરતી બકરીઓ માટેના કુલ મિશ્રિત આહારમાં જીવંતી/ડોડી અને બાયપાસ ફેટ અનુક્રમે ૧ અને ૨ % પ્રમાણે આપવાથી દૂધ ઉત્પાદનમાં ૨૨ % અને દૂધના ફેટમાં ૧૦ % નો વધારો થાય છે અને આહાર ખર્ચ પરના વળતરમાં દેનિક બકરી દીઠ ₹ ૨ નો વધારો થાય છે.

- સંશોધન વૈજ્ઞાનિક અને વડા, પશુપોષણ સંશોધન કેન્દ્ર, આકૃયુ, આણંદ -૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૬૨) ૨૬૩૪૪૦
ઈ-મેઈલ : pareshpandya@aau.in

૧૫.૬ સુરતી બકરીના લવારા માટે કુલ મિશ્રિત પશુઆહાર

સુરતી બકરા પાલકોને ભલામણ કરવામાં આવે છે કે બકરીના નર લવારાઓને સાત માસથી એક વર્ષની ઉંમર સુધી વધુ પ્રોટીન (૧૪ ટકા) અને વધુ શક્તિ (૬૮ ટકા) કુલ પાચ્યતત્ત્વો ધરાવતો કુલ મિશ્રિત પશુ આહાર અને ત્યારબાદ બે માસ સુધી ૧૧.૫૦ ટકા પ્રોટીન અને ૬૮ ટકા કુલ પાચ્યતત્ત્વો ધરાવતો કુલ મિશ્રિત પશુ આહાર આપવો જોઈએ કે જેનાથી તેમની દૈનિક વૃદ્ધિદર અને ખોરાકને શરીરના વજનમાં રૂપાંતર કરવાની ક્ષમતામાં વધારો થાય છે તેમજ પ્રતિ ક્રિ.ગ્રા. વજન વધારવા માટે થતા ખોરાકીય ખર્ચમાં ૨૪ ટકાનો ઘટાડો થાય છે.



બકરાને આપવામાં આવતા પશુઆહારમાં કુલ મિશ્રિત ખોરાકના ઘટકો

ક્રમ	ખોરાકના ઘટકો	૭-૧૨ માસ સુધીના સુરતી નર લવારાને અપાતો કુલ મિશ્રિત પશુઆહાર (૧૪% પ્રોટીન, ૬૮% કુલ પાચ્યતત્ત્વો)	૧૨-૧૪ માસ સુધીના સુરતી નર બકરાને અપાતો કુલ મિશ્રિત પશુઆહાર (૧૧.૫% પ્રોટીન, ૬૮% કુલ પાચ્યતત્ત્વો)
૧	જુવાર બાદુ	૪૫.૦૦	૪૫.૦૦
૨	સોયાબીન ખોળ	૧૫.૦૦	૦૮.૫૦
૩	મકાઈ	૨૪.૦૦	૨૮.૦૦
૪	તેલ રહિત ચોખાનું થુલુ (ડી.ઓ.આર.બી.)	૦૦.૦૦	૦૪.૦૦
૫	ચોખાની કુર્કી	૦૪.૫૦	૦૦.૦૦
૬	ગોળની રસી	૧૦.૦૦	૧૦.૦૦
૭	ક્ષારમિશ્રણ	૦૧.૦૦	૦૧.૦૦
૮	મીઠું	૦૦.૫૦	૦૦.૫૦
૯	વિટામિન એ, ડી.ડી. (ગ્રામ/૧૦૦ કિલો)	૦૦.૦૬	૦૦.૦૬

- સંશોધન વૈજ્ઞાનિક અને વડા, પશુપોષણ સંશોધન કેન્દ્ર, આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦ ફોન્: (૦૨૬૬૨) ૨૬૩૪૪૦
ઈ-મેઈલ : pareshpandya@aaau.in

(૧૬) મત્સ્ય ઉછેર

૧૬.૧ ગામ તળાવમાં હાપા પદ્ધતિથી ફાયનું વધુ ઉત્પાદન

મત્સ્ય પાલન કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે, ગામ તળાવમાં હાપા પદ્ધતિમાં ૭૫૦ નંગા પ્રતિ ઘનમીટર રોહુ સ્પોનનો સંગ્રહ કરવાથી ફાયના વધુ ઉત્પાદન સાથે વધુ આર્થિક વળતર મેળવી શકાય છે.



- વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આકૃયુ, દેવાતજ-૩૮૭૨૪૦ ફોન (૦૨૬૫૨) ૨૮૧૩૨૭ • ઈ-મેઈલ : kvkdevataj@aau.in

અને વરિષ્ઠ વૈજ્ઞાનિક, કેન્દ્રીય મીઠા પાણી જીવપાલન અનુસંધાન સંસ્થા (સીઝા), આઈસી.એ.આર., આણંદ - ૩૮૮૦૦૧ ફોન : (૦૨૬૫૨) ૨૬૩૬૫૫

(૧૭) ઇન્ફોર્મેશન ટેકનોલોજી

૧૭.૧ પાક સંરક્ષણની માહિતી માટે ડીસિઝન સપોર્ટ સીસ્ટમનો ઉપયોગ

આણંદ કૃષિ
યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવેલ ડીસિઝન સપોર્ટ સીસ્ટમ ફોર પ્લાન્ટ પ્રોટેક્શન જંતુનાશકો, ફૂગનાશકો, નીદાણનાશકો અને વૃદ્ધિવર્ધક નિયંત્રકોના વપરાશની માહિતી ‘કીટનાશક કાયદો -૧૯૬૮’

પ્રમાણે ગુજરાતી ભાષામાં પુરી પાડે છે. તેથી ખેડૂતોને ડીસિઝન સપોર્ટ સીસ્ટમ ફોર પ્લાન્ટ પ્રોટેક્શનનો ઉપયોગકરવા ભલામણ કરવામાં આવે છે.



- નિયામક, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આકૃયુ, આણંદ - ૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૫૨) ૨૨૫૮૮૦ • ઈ-મેઈલ : dit@aau.in

અનુભવ ટ્રાયકોડમા

આ સી.આય.બી. અને આર.સી., નવી હિલહી રજિસ્ટર્ડ ટ્રાયકોડમા વીરીડીનું ઉત્પાદન છે. ટ્રાયકોડમા પાકમાં આવતા બીજ-જન્ય તેમજ જમીન-જન્ય રોગો જેવા કે સુકારો, મૂળનો કોહવારો, થડનો કોહવારો, હરુ મૃત્યુ વગેરેનું નિયત્રણ કરે છે.

માવજત : ● બીજ માવજત : બીજને ટ્રાયકોડમાથી ૧૦ ગ્રામ પ્રતિ કિલો બિયારણ પ્રમાણે વાવેતરના સમયે માવજત આપવી. ● જમીન માવજત : ૧.૨૫ કિલો ટ્રાયકોડમા ૧૨૫ કિલો સેન્ટ્રિય ખાતર જેવી કે છાણિયું ખાતર અથવા દિવેલીના ખોળ સાથે સારી રીતે ભેણવાને ચાસમાં આપવું. ● ધરુને માવજત : ૧ થી ૧.૫ કિલો ટ્રાયકોડમા ૧૦ લિટર પાણીમાં ઓગાળી દ્રાવણ કરી ધરુના મૂળને દ્રાવણમાં ડૂબાડી રોપણી કરવી. કેળની ગાંઠો, શેરીના કટકા વગેરેને પણ આ પ્રમાણે માવજત આપવી. ● ૧ કિલો ટ્રાયકોડમાને ૫૦ ડિલો છાણિયું ખાતર, વર્મિકમ્પોસ્ટ, દિવેલી, રાયડા, લીમડા વગેરના ખોળ સાથે સંવર્ધિત કરી શકાય છે.

: વધુ માહિતી માટે સંપર્ક :

સેન્ટર ફોર રિસર્ચ ઓન બાયો એજન્સી, વનસ્પતિ રોગશાસ્ક વિભાગ, બં.અ. કૃષિ મહાવિદ્યાલય,
આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - ૩૮૮ ૧૧૦ • ફોન : (૦૨૬૬૨) ૨૬૨૪૪૫



અનુભવ મધ

● શુદ્ધ અને કુદરતી મધ ● વૈજ્ઞાનિક પદ્ધતિ વડે કાઢવામાં આવેલ મધ ● વિવિધ પ્રકારના ફ્લોરલના પ્રાપ્ત મધ

: વધુ માહિતી માટે સંપર્ક :

કૃષિ ક્રીટકશાસ્ક વિભાગ, તુલસી બિલ્ડીંગ, બં.અ. કૃષિ મહાવિદ્યાલય,
આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - ૩૮૮ ૧૧૦

ફોન : (૦૨૬૬૨) ૨૮૫૭૧૩/૨૮૫૭૧૪ • ઈ-મેઈલ : pkb5458@aau.in



અનુભવ વર્મિકમ્પોસ્ટ

આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત
અનુભવ વર્મિકમ્પોસ્ટ મેળવો



(બાયોટેકનોલોજી દ્વારા ઉત્પાદિત સેન્ટ્રિય ખાતર)

પેટિંગ સમયે વજન ૫૦ ડિલો (લેજનુકા)

વેચાણ કિંમત : ₹ ૩૦૦/-

: સંપર્ક :

પશુ સંશોધન કેન્દ્ર

વર્મિકમ્પોસ્ટ યુનિટ, વેટનરી કોલેજ, આકૃષુ, આણંદ-૩૮૮૧૧૦

ફોન : (૦૨૬૬૨) ૨૬૦૧૧૨

અનુભવ

ચીલેટેડ મિનરલ મિક્સિયર



પશુપાલકોના હિતમં...

પશુપોષકાનીઓ દ્વારા ઉત્પાદિત કરેતું વિસ્તાર મુજબનું

'અનુભવ ચીલેટેડ મિનરલ મિક્સિયર'

તમામ વર્ગના પશુઓની નેતૃત્વરસી, પ્રજાના અને દૂધ ઉત્પાદન માટે સર્વોત્તમ છે.

: સંપર્ક :

સંશોધન પેણાળિકશી અને વડા, પશુપોષક વિભાગ,

આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - ૩૮૮૧૧૦


ફોન : ૦૨૬૬૨-૨૬૩૪૮૦

નોંધ : નોંધ વાળનો જરૂરિયાતી વિષાની નોંધની ને તે રૂમ અની લાઘવ સેવાની સેવા મેળવીનીએ નોંધની

‘કૃષિગોવિદ્યા’ પ્રકાશન વિભાગ, વિસ્તારણ શિક્ષણ નિયામકની કચેરી
આણંદ કૃષિ ચુનિવર્સિટી દ્વારા વિવિધ વિષયો ઉપર પ્રકાશિત કરવામાં આવેલ પુસ્તકો મેળવો




કિંમત : ₹ ૬૦/- (રબર) રૂ ૧૧૦/- (રજી. પોસ્ટથી)



કિંમત : ₹ ૧૦૦/- (રબર) રૂ ૧૬૦/- (રજી. પોસ્ટથી)



કિંમત : ₹ ૭૦/- (રબર) રૂ ૧૧૦/- (રજી. પોસ્ટથી)




કિંમત : ₹ ૬૦/- (રબર) રૂ ૧૦૦/- (રજી. પોસ્ટથી)



કિંમત : ₹ ૫૦/- (રબર) રૂ ૧૦૦/- (રજી. પોસ્ટથી)



કિંમત : ₹ ૫૦/- (રબર) રૂ ૧૦૦/- (રજી. પોસ્ટથી)



કિંમત : ₹ ૬૦/- (રબર) રૂ ૧૩૦/- (રજી. પોસ્ટથી)



કિંમત : ₹ ૮૦/- (રબર) રૂ ૧૪૦/- (રજી. પોસ્ટથી)




કિંમત : ₹ ૫૦/- (રબર) રૂ ૧૦૦/- (રજી. પોસ્ટથી)



કિંમત : ₹ ૪૦/- (રબર) રૂ ૮૦/- (રજી. પોસ્ટથી)



કિંમત : ₹ ૮૦/- (રબર) રૂ ૧૨૦/- (રજી. પોસ્ટથી)




કિંમત : ₹ ૮૦/- (રબર) રૂ ૧૫૦/- (રજી. પોસ્ટથી)

ખેડૂતોપયોગી સંશોધન ભલામણો ૨૦૧૮




ફિલ્ટરેન વરસાના ડાટાલાણો

અનંત રૂપ કુન્જાણી
કિંમત : ₹ ૪૦/- (રબર) રૂ ૮૦/- (રજી. પોસ્ટથી)



કિંચન ગાર્ડન

કિંમત : ₹ ૪૦/- (રબર) રૂ ૮૦/- (રજી. પોસ્ટથી)



નોંધાવાના આત્મનિર્ભાવ વિભાગ

કિંમત : ₹ ૭૦/- (રબર) રૂ ૧૧૦/- (રજી. પોસ્ટથી)




કેરી ઉલ્લોગ

કિંમત : ₹ ૮૦/- (રબર) રૂ ૧૨૦/- (રજી. પોસ્ટથી)



ફૂલ પાકો

કિંમત : ₹ ૮૦/- (રબર) રૂ ૧૨૦/- (રજી. પોસ્ટથી)




કિંમત : ₹ ૪૦/- (રબર) રૂ ૮૦/- (રજી. પોસ્ટથી)



મધ્યમાખી પાલન

કિંમત : ₹ ૫૦/- (રબર) રૂ ૧૦૦/- (રજી. પોસ્ટથી)



ગુહ ઉલ્લોગ તરીકે લેકરી યાણગીયો

કિંમત : ₹ ૯૦/- (રબર) રૂ ૧૦૦/- (રજી. પોસ્ટથી)




માનવ
આધાર અને
પોષણ

કિંમત : ₹ ૫૦/- (રબર) રૂ ૯૦/- (રજી. પોસ્ટથી)



મસાલા પાકો

કિંમત : ₹ ૮૦/- (રબર) રૂ ૧૨૦/- (રજી. પોસ્ટથી)



જળાય ખેતી

કિંમત : ₹ ૬૦/- (રબર) રૂ ૧૦૦/- (રજી. પોસ્ટથી)

: વધુ માહિતી માટે સંપર્ક : તંત્રી, કૃષિગોવિદ્યા, પ્રકાશન વિભાગ, વિસ્તરણ શિક્ષણ નિયામકક્ષીની કચેરી ચુનિપરસ્ટી ભવન, આણંદ કૃષિ ચુનિપરસ્ટી, આણંદ જી. આણંદ પિન : ૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૬૨) ૨૨૪૮૮૭, ૨૬૧૬૭૧
ઈ-મેઇલ : aaunews@aua.in

અનુભવ પ્રવાહી બાયો એન.પી.કે. જૈવિક ખાતર સમૂહ (BIO NPK CONSORTIUM)



નાઈટ્રોજન
સ્થિર કરનાર

ફોસ્ફેટ કલ્ચર

પોટાશ કલ્ચર

વિશિષ્ટતા અને ફાયદા

- ◆ વપરાણની અવધિ ૧ વર્ષ
- ◆ ૫૦ કરોડ સૂક્ષ્મળાખાળું પ્રતિ મિલિ લિટર, પાંચ બેક્ટેરીયાનો સમૂહ
- ◆ પ્રતિ હેક્ટર, પાક ફીઠ ૨૫-૩૦ ટકા નાઈટ્રોજન, ૨૫% ફોસ્ફરસ અને ૨૫% પોટાશ ખાતરની બચત
- ◆ ઉત્પાદનમાં ૧૦% ટકા નો વધારો
- ◆ જમીનનું જૈવિક, રાસાયણિક તેમજ ભૌતિક બંધારણ સુધારે
- ◆ વપરાણ અને વહન સરળ, ટપક પદ્ધતિ અને ગ્રીનહાઉસમાં આસ ઉપયોગી છે
- ◆ સેન્ટ્રિય ઝેતીનું અનિવાર્ય અંગ, કિફાયતી તેમજ પર્યાવરણ માટે સુરક્ષિત છે
- ◆ વિટામિન તેમજ વૃદ્ધિ વર્ધકો બનાવી છોડને પોષણ પૂરું પાડે છે
- ◆ બિયારણનો ઉગાવાનો દર વધારે છે.
- ◆ વધુમાં રોગકારક ફૂગ તથા ફૂભિથી પાકનું રક્ષણ કરવાની ક્ષમતા ધરાવે છે.

પેકિંગ : ૫૦૦ મિ.લિ. રૂ ૨૦૦/- અને ૧ લિટર રૂ ૪૦૦/-

પ્રાપ્તિ સ્થાન : સૂક્ષ્મ જીવાણુશાસ્ત્ર વિભાગ અને બાયોફર્ટિલાઇઝર પ્રોજેક્ટ
ત્રિભુવન ખેડૂત શાંતાલયની બાજુમાં, બી. એ. કોલેજ પાસે

આ.કુ.ચુ., આણંદ-૩૮૮૧૧૦

ફોન : (૦૨૬૬૨) ૨૬૦૨૧૧ / ૨૨૫૮૧૩

E-મેલ : rvvyas@aau.in

(જાના દિવસો સિવાય સમય સવારે ૮ થી ૧૨ સાંજે ર થી ૫)

આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત કૃષિ સામયિક **‘કૃષિગોવિદ્યા’ના સભ્ય બનો**



**વાર્ષિક
લવાજમ
₹ 200/-**



**પંચવાર્ષિક
લવાજમ
₹ 600/-**

: લવાજમ તથા વધુ માહિતી માટે :

તંત્રી, કૃષિગોવિદ્યા, પ્રકાશન વિભાગ,
વિસ્તારા શિક્ષણ નિયામકશીની કચેરી, યુનિવર્સિટી ભવન,
આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ જી. આણંદ પિન : ૩૮૮૧૧૦
ફોન : (૦૨૬૬૨) ૨૬૧૬૨૧ • Email : aaunews@aau.in

નોંધ : લવાજમ મનીઓર્ડરથી તથા બેંક ફ્રાફ્ટરથી આણંદ કૃષિ યુનિવર્સિટી ફંડ એકાઉન્ટસ
આણંદના નામે ખ્વીકારવામાં આવે છે

**‘કૃષિગોવિદ્યા’ના લેખોમાં આપેલ ઐજાનિક માહિતીનો
ઉપયોગ કરી આપની ખેતીને સમૃદ્ધ બનાવો**